

શ્રી યતોપીજયણ

દૈન ગંધીમાળા।

દાસીલાલ, નાનાબન્દ.  
ફોન : ૦૨૭૨-૨૪૨૫૩૨૨  
૩૦૦૧૮/૧૬

૧૫૫૨  
૨૬૦  
~~૧૫૭-૬૦~~  
જૈન શુલેચ્છક પત્રના આહકોને લેટ.

દાસીલાલ

ભોગિયો



અકાશક,

પુરુષ-તમદ્વાસ જીગાભાઈ શાહ.

“ જૈન શુલેચ્છકના ” અધિપતી.

ભાવનગર.

કીમત રૂ. એક.

## ગ્રસ્તાવના,

“ ફોન્ડ્રેન્સ ” જેવી મહદ્વ સંસ્થા કે જેના ઉપર આપણે અને આપણી સમય ડામના ઉદ્યોગ આધાર છે. ને આપણે સંમારે સુધ્યારો ધર્મ કર્તાય અને વ્યવહાર દક્ષતા શીખને છે. તેનો ગુનમથી અન્યાની પર્યાતનો દરેક દરેક જૈનને ભાસુવાની આસ જરૂર છે.

ઉંડેઝાલ આવશ્યક કૃત્ય અને કરવાનો સાંચન તરીકે દર વર્ષ ફોન્ડ્રેન્સ ગોદ્દીય વાર્ષિક સર્વયુ રજુ કરે છે ત્યારે દરવર્ષ બ રીતી ફોન્ડ્રેન્સના રિપોર્ટો તે તે ગામ તંડુથી પ્રકાશમાં મૂક્તામાં આવે છે આ સથળું છનાં તે દરેક છૂટું છૂટું અને ડિમટી હેલાલથી દરેક તેનો લાભ ન લઈ શકે તે સવભાવિક છે અને તેથી અમોઅ આ ભોગ્યાંતેયાર કરવા જરૂર વિચારી છે.

આ ચંચ તૈયાર કરવામાં ભી દેખયાંદ દામજ કુંડલાકરે લી ધેલ પરિશ્રમ ગારે તેમને માન ધટે છે. તથા ને જે અગ્રોની મહદ્વ લીધી છે તેના કર્તાનો ઉપકાર માનવામાં આવે છે.

લી. નમ્ર

ભાવનભર.  
તા. જ્યોતિષ ૧૫૦૮ }  
પ્રદીપ ૧૮૭૮  
છુટી ફોન્ડ્રેન્સ,

પુરુષોત્તમ ગીગાભાઈ શાહ  
મેનેજર જૈન શુંભેષ્ઠક.



# કોન્ફરન્સનો લોમિયો ( દૂત )

દુષ્પ્રાપ્તિસ્વરૂપ દસ્તાવેજ.

## વિભાગ પહેલો.

કોન્ફરન્સ એટલે શું? તેની આવરણકા.

જેન બન્ધુઓને માટે કોન્ફરન્સનું ઉપયોગી મંડળ સ્થાપન થયાને લગભગ છ વર્ષ જેટલો લાંબો વખત થયા પછી અને તે વખત હરમિયાન કેમે અનેક પ્રત્યક્ષ અને પરોક્ષ ફાયદા જેવા છતાં હજુ આપણુંમાં એવો પણ મેટા ભાગછે કે જે કોન્ફરન્સનો અર્થ અને ઉદ્દેશ ન સમજવાથી તેને નિંદેછે, કુચોડેછે અને તેને બની શકે તો તોડી પાડવાનો યન્ત્ર કરેછે કેને સ્થિતિજ અમને કોન્ફરન્સનો અર્થ સમજવવાને કરજ પાડેછે. કહેવું જોઈએ કે આપણુંમાં કોન્ફરન્સ એ કંઈ નવું ડહાપણ કે નવું બંધારણ નથી. પરંતુ મુળ ધોરણનું નવું અને જમાનાને અનુકૂળ સ્વરૂપછે. જેન તિર્યોએ પનિત્ર બુર્જ હોયને એકાંત અને શાંત ચિત્તે લક્ષ્ણ કરવા માટે જરૂરનું સ્થાન છતાં લ્યા મેળા તરીકે શ્રી શાંધને મોટા પ્રમાણુંમાંએકત્ર થવાને આપણું વડીલોએ શામાટે શરૂઆત કરીછે તે માટે આપણે જે વિચાર કરીશું તો પછી સહજ સમજ શકાશે એ સંમેલન પણ કોન્ફરન્સનું એક સ્વરૂપ છે. અને તેવા સંમેલનની જરૂર જેવાથીજ પુર્વ પુરુષોએ શાંત અને એકાંત ભાવના ભાવવાના સ્થળોમાં તે વૃત્તિની અનુકૂળતાના લોગે પણ દર વર્ષ અને છ માસે તેવા મેળાવડા શરૂ રાખવાનું ડહાપણ વિચાર્યુંછે. અવખત આવા સંમેલનનો ઉદ્દેશ પ્રયત્ન તેઠલાથીજ સંપૂર્ણ કળી ભૂત થતો હતો પરંતુ જમાનાના વહેલા સાથે મુળ ઉદ્દેશ ભુલાય જવામાં આવ્યો અને તેને બદલે

ઈણા બંધ એકત્ર થઈ હોડા હોડી અને ધકા મુકીમા દર્શન કર્યો  
ન કર્યો અને નાસવાનો વખત આંદો અને તે રીતે અરસ્પરસ  
વિચારોની આપલે કરવાનું વિસરાઇ જવામાં આંદું તેમ શાંત  
ચિતે ભક્તિ કરવાની વાત પણ બુલાઇ જવામાં આવી લારે પછી  
કોમના એકીકરણુંયાને વિચારનો કુય વિફુય થવાનો કોન્ક્રિન્સના  
નામે સંમેલન કરવાનો વિચાર કરવામાં આવેલાં અને તે રીતે  
કોન્ક્રિન્સએ પુર્વથી ચાલતા આવેલા રીવાજનું સુધરેલું બંધારણુંછે.  
તેમ આપણે નોંધ શકીએ છીએ.

આ ઉપરથી સહજ સમજ શકાશો કે કોન્ક્રિન્સએ આપણા  
એકાકાર સ્વરૂપનું નામછે લારે તેની સ્વરૂપ શોલા, અતિ વૃદ્ધિ,  
અને મજબુતી કરવાને પોષક તરીકે કામ કરવાની તેના અંગોપાંગ  
ગણુંતી સમચ્ર જૈન પ્રભાની સરખી ફરજ છે. અમોને સખેદ આશ્ર્ય થાયછે  
કે આ ફરજ ધણો ભાગ સમજતો નથી અને તેથી કેટલીક વખત  
કાર્ય કરનારનો ઉપકાર માંનવાને ખફદે તેને નિંદેછે. તથા અપમા-  
નીત કરવા યત્ન કરેછે. પરંતુ તેમણે સમજવું જેઠાં કે તેમ  
કરવામાં તેઓ ખરી રીતે પોતાની જતને નિંદેછે અને પાછી પાડે  
છે. એટલુંજ નહિ પરંતુ જઈન કોમના અભ્યુદયનું ખુન કરેછે.  
અને તેથી તેઓ જઈન કહેવરાવવાનેજ ખરી રીતે ચોગ્ય પાત્ર  
થઈ શકતા નથી. કોન્ક્રિન્સનો જન્મ આપવા માટે કાર્ય વાહુકો અને  
કાળજીવાળાઓને શું પરિશ્રમ કરવો પડ્યો? કેટલીજહેમત ઉઠા-  
વવી પડી અને કેટલાઓને સમજવવું પડ્યું તેનો વિચાર કરવા  
પછી તેમના આ ઉમહા યત્નન્દા પરિણામે છ વરસમાં આપણી  
કોમનાં કે કંઈ જગૃતિ સુધારા અને સખાવત થવા પામી છે તે  
કેને માટે છે તેનો વિચાર કરવા પછી સૌ કેાઈ કણુલ કરશો કે  
કાર્ય વાહુકો પોતાના કિમતી વખત શારિરિક શરૂ અને યથા શક્તિ  
ધનના લોગે પણ નિઃસ્વાર્થ. કોમનો અભ્યુદય છચેછે લારે પછી  
આમારી આવીછે કે અજાન વિચારો હુંવે હુર કરીને તેમને કાર્યમાં

મદદ કરવા અને સ્વખળે આગળ વધવા સૌ તૈયાર થશે. અને જો કદાચ આગેવાનોની જો હુકમી અથવાતો એકહથી સ-તા જોવાતી હુશે તો તેપણું આ ઘોરણે ફેરવી શકશે.

મારામારિ અને શાંતિના એક સરી પૂર્વના વચ્ચા પ્રસંગમાં કે જ્યારે લોકોને જેતાની જતને સુધારવા કે સંભાળવાનો પણ ઓછો અવકાશ મળતો તે જમાનેઃ જવા પછી કેળવણીના પ્રતાપે અને શાંતિના શામરાજ્યે જન સમુહને પોતાના નાતિય સુધારા તરફ દો રાચ્યા તે જીપરથી કુમશઃ નેશનલ કેંચ્રેસનો જન્મ ત્રેવીશ વર્ષ પુર્વે હિંદુમાં થતા પાર્થેઓ; અને તે પછી થોડા વર્ષમાં અપણા જૈન બંધુ ગુરુભયંદળ ઢાંચે વિચાર થયો કે આખા હિંદની જુહી જુહી જાતિ અને જુહા જુહા ધર્મના જુહા જુહા પ્રાંતમાં વસ્તા લોકો એકત્ર મળી પોતામા રાજક્ષિય સત્તા વધારવા માટે વિચારો કરી લાભ મેળાની શકે છે તો એકજ ધર્મના દરેક પ્રાંતના લોકો મળી નેપોત પોતાના ધર્મમાં એકતાં કેમ ન વધારી શકે ? આ સધળું છતાં તે વિચાર તેમના એકનાથી અમલમાં સુકલ્ય શકે તેમ નહોતો અને રેલવેઓ તુર્તમાંજ વધતી જતી હોવાથી હળ એકખીન પ્રાંતોમાં અવર જવર અને ઓળખાણુ પીછાણ વધ્ય ગઈ નહોતી તેમ જૈન વર્તમાન પત્રોનું સાધન પણ તે પ્રસંગે નહિ હતું તેથી ઉપરના વિચારો તેમને હૃદયમાઝ દાખી રાખેવા પડ્યા.

આ પ્રસંગે જૈનમાં એકમાસિક નામે " જઈન ધર્મ પ્રકાશ , , ભાવનગરમાં નીકળતું હતું જેના મંત્રો હોશી કુંવરલુ આલુંદળ ના હૃદયમાં પણ અનુકૂમે તેવોજ વિચાર ઉમજ થવા પાર્થેઓ. અને તે તેમણે હાવી ન રાખતાં જઈન ધર્મ પ્રકાશના પુસ્તક ૮ અંક ૭ સં ૧૯૪૬ ના અંકમાં પ્રગર કર્યો. પરંતુ તેટલાથી લોકોનું લક્ષ તેના તરફ ગયું હોય તેમ જેવાઈ શકાયું નહિ. કેમકે તેના સંભધમાં જઈન પ્રજનના વિચારો જુદ્ધી માગણીથી મેળવવાનું જણાવવા છતાં એક પણ નોંધ આવી હતી નહિ શકે એમ માની એકે આ વિચાર પ્રજનના ફેટલાક ભાગને તેજ વખતે દૃચ્યો હુશે, છતાં ઐહની વાતાં

કે આપણો વર્ગ મનમાં વિચારોને શુંગળાવી નાંખવામાં હુલુ ડહાપણું સમજતો જેવાય છે. કોઈને ફુઃખ ન હેવું એ મુખ્ય સિદ્ધાંત છતાં પોતાનાજ મનોભાવને દ્યાવી ભારી નાંખવા સુધીની સુર્જિતા કરવી તે શું દ્યા છે ? પોતાની જાતે કાળજીથી વિચારો આપવા ખાનુઅ રહ્યા પરંતુ જ્યારે બીજાઓ તરફથી વિચારો માંગવામાં આવે છતાં પણ તેના તરફ હુલ્લેક્ષ રાખી કામ લેવાય તો તેનાથી વધારે હીલગીર થવા જેવું અમો તો બીજું કંઈ જોઈ શકતા નથી.

આ ગ્રમાણે સમાજના વિચારો મેળવવા વરષ ઉપરાંત યત્ન કરવા છતાં જ્યારે કંઈ પણ પરીણામ જેવામાં ન આવ્યું લારે ભાવનગર જધન ધર્મ પ્રસારક સભાએ એક પગલું આગળ ભરવા ગોડવણું કરી. અને તેથી ૧૯૫૦માં કારતકી પુર્ણિમા ઉપર શ્રી શત્રુજય યાત્રાળુઓમાં છુટાં હેંડથીલ વહેંચી તે રીતે જધન કેંચેસની આવશ્યકતા સમજાવવા યત્ન કર્યો. અને શેઠ આણુંદળ કલ્યાણાલ વગેરેને વાકેક કરી બીજે દિવસે લાં જહેર સલા લરી અને આ કાર્ય હુથ ધરવું તેવો નિશ્ચય થતાં આગળ વધવું કેમ તે વિચારને માટે આગેવાનોની એક મિટ્ટીંગમાં તથા ત્યારણાદ શેઠ આણુંદળ કલ્યાણાલના પ્રતિનીધીઓ વગેરે ધણા સ્થળોના આગેવાનો રૂખરૂની ખોળમિટીંગમાં તે વિષયની જરૂરીયાત પુષ્કળ ચર્ચાવા પછી પહેલી કેંચેસ અમદાવાદમાં ભરવાનું હર્યું અને તે ગ્રમાણે ૧૯૫૦ના ફાગણ શુદ્ધી. ૧૨-૧૩-૧૪-૧૫ તા. ૧૮થી ૨૧ માર્ચ. ૧૯૬૭ના ચાર દિવસો પહેલીકેંચેસ નામથી એક સલા અમદાવાદમાં નગરશોઠના ખંગલામાં ભરવામાં આવી કે જેમાં ૬૦ ગામોમાં આમંત્રણું કરવામાં આવેલું હતું જ્યારે ફૂકતા રૂ ગામથી ૬૨ થહુસ્થોએ હુાજરી આપી હતી. તેથી તેઓ તથા અમદાવાદી અંધુઓની મોટી હુાજરી વચ્ચે કામ લેવામાં આવ્યું કે જે પ્રસંગે મુખ્યત્વે નીચેના ઠરાવો પસાર થયા હતા-

૧ છાપરીઆળી પાંજરા પોળમાં એક ( પણ વૈધ ) વેટેરીનરી સરજન રાખવો જોઈએ.

૨ છાપરીઆળી પાંજરા પોળ માટે પ્રથમ ઘર દીક ઝા. ૧ થી ૫ સુધી લેવા રીવાજ કરેલ હતો: તે ઠરાવને આ સલા મંબુર રાખેછે.

૩ શ્રીસિદ્ધાચળજીના રખોપાને માટે કરવા પડતા ખર્ચને પહોંચી વળવાને શરૂ કરેલી રખોપાટીપ ઉત્સાહ પૂર્વક લરાવી જોઈએછે.

૪ સુર્યિદાખાદ નિવાસી બાળુ લક્ષ્મિપતિસિંહજી તથા બાળુ ધનપતિસિંહજી પાસે જે સિદ્ધાચળજીના રૂપિયા ખાડીએ તે વસુત કરી લેવા.

૫ પાદીતાણુની ધર્મશાળાવાગા યાત્રાળુંએ પાસેથી અમુક રકમ લઈ ઉત્તરવા હેઠે તે રીવાજ બંધ કરાવવો જોઈએ.

૬ આગણું જીર્ણ મંદીરોનો ઉદ્ઘાર કરવવા જરૂર છે.

૭ તિર્યોના વહીવટ રીતસર અને સારા ધોરણે ચાલે તે માટે કંધ પણ બંદોખસ્ત થવો જોઈએ.

૮ શુરૂ હેમચંદ્રજી ખરતરગઢવાગા તેમાં ગડખડ મચાવી રહ્યા છે તેનો બંદોખસ્ત થવા જરૂર છે.

૯ પાદીતાણુના ખારોટ લોકો જે આસાતના અને અડયણુ કરેછે તે માટે કંધ ગોઠવણુ થવાની આવશ્યકતા છે.

૧૦ જાન ભંડારો નવા કરવા તથા જીર્ણ પુસ્તકોદ્ઘાર કરવાની જરૂર સ્વીકારવામાં આવેછે.

૧૧ ખીજુ જઈન કેંચેસ મુખ્યમાં ભરવી. આપ્રમાણે તેમાં ઠરાવ પસાર કરી કાર્યની શરૂઆત કરવામાં આવી.

ઉપર જોઈ ગયા તેમ પ્રથમ કેંચેસના નામે ભરાએલ પરીષદના ઠરાવો તરફ દિલ્લી કરતાં સહજ જ્ઞમજી શકાય છે કે તે ખરૂં કહીએ તો પાદીતાણુના વહીવરની વ્યવસ્થા અને સુધારાપર વિચાર કરવાને મળેલી એક કંમિટી અથવા તો આણુંદળ કલ્યાણાલનું ખરૂં તત્ત્વ પોતાના હસ્તકના ખાતાનો વિચાર કરવાને મળેદું હતું. ગમે તેમ પણ તેમણે એકજ ખાતાના સંબંધમાં ઠરાવોનો જે ખરડો ધડી કાઢવો હતો તે બહુ વખાણુવા જોગ છે તેમ છઠેવામાં ખીલકુલ

અતિખ્યેાક્ષિ નથી. છતાં તેજ પ્રસંગે કુહેવું જોઈએ કે જ્યારે તે ઠરાવો એકજ સંસ્થાના સંબંધમાં હોવા છતાં તેનો પુરો અમલ થવામાં ન્યુનતા જોવાય છે તો તે તેના કરતાં વધારે દલગીર થવા જેવું છે.. ગમે તેમ પણ તે પછી હીજ જઈન કેંચેસ મુખ્ય આતે ભરવાનો ઠરાવ લ્યારપછી અમલમાં આવી શક્યો ન હોતો તેવા પ્રસંગે કદાચ આ દરેક ઠરાવો કાગળ ઉપરજ રહી ગયા હોવાનું અનુમાન થઈ શકેછે. પરંતુ હુંવે જ્યારે જઈન કેંચેસ પુનઃ કોન્ફરન્સના નાના નામથી પણ : જાતના કામ કરતી જગૃતિમાં આવી છે તોપછી તે ઠરાવ માંણેના ટેટલાક સુચનારૂપે અને ટેટલાક ઠરાવરૂપે પુનઃયાદમાં લાવવાની જરૂર શ્રી કોન્ફરન્સના નેતાઓએ વિચારવી જોઈએછે. સદરહુ અમદાવાદ જઈન કેંચેસનો પ્રથમ ઠરાવ દરેક પાંજરાપોળને ઉપાડી લેવા જોવો છે. કેમકે, આપણા તરફથી જે પાંજરાપોળ ઉઘડવામાં અને તેમાં લાણો રૂપિયા ખર્ચ કરવામાં આવેછે તે ઇક્તા માતેશા સાંઢાને માટે કે સરવાળે સુંય ગણ્યાતાં લવારાંઓ અને ગાડરડાંઓને માટેજ નહિ. પરંતુ માંદા, અશક્તા, અને રણડતાં દરેક જનવર યાને મુંગા જીવોના આશ્રમ તથા રક્ષણુને માટે છે. અને તેથી ખર્દું કહીએ તો પાંજરાપોળો તે માંદા પણપક્ષીનો માળવો છે. છતાં ઐદની વાત એ છે કે હુલમાં ચાલતી પાંજરાપોળોમાં તે વાત તરફ સેંકડે પાંચ પાંજરાપોળ ભાગયેજ લક્ષ આપેછે લારે આવતા જનવરોને ધાસ ચારો આપવામાં પોતાને કૃત કૃલ્ય સમજતી પાંજરાપોળાની સંખ્યા મોટી થવા જાયછે. અને તેને માટે આ ઠરાવ તરફ અમો લક્ષ ઐંચી શકીશું કે પાંજરાપોળમાં ( પણ વૈધ ) વેટેરીનરી સરજન રાખવાની દરેક પાંજરાપોળના વ્યવસ્થાપકોએ પ્રથમ કરજ વિચારવી જોઈએ છે.

ખીનો ઠરાવ કે જે છાપરીઆળીની પાંજરાપોળ માટે પ્રથમ ઘર દીઠ ઝાળો લેવાનો રીવાજ હુશે તેનો પુનરોદ્ધાર કરવા માટેનો હુતો તેનો અમલ કરવાના વીલંબ માટે તોને દોષીત ગણ્યવા તે એક ગંભીર ગ્રસ છે. છાપરીઆળીની પાંજરાપોરમાં દરવર્ષ આવક

કરતાં મોટી રકમનું ચાંદું ખર્ય છે તે સર્વ કોઈ સમજે છે, અને આ 'વધારાને' ખર્ય હુમેશાં પાલીતાલ્યાની પેઢી ખાતે માંડી પુરા પાડું જાયછે. અમો ન બુલતા હોઇએ તો આ ખાતાની રકમને સરવાળો એક વખત એકલાખ ઉપર ગયો હતો પરંતુ તે આંકડો એક સાથે કંચી બનંદુ કેશવળ નાયકે ભરપાય કર્યો હતો જ્યારે પાછી તે પછી જિધાર બાજુ શરૂ થયાછે અને હવે તે ભરપાય કરનાર વર્ગ નીકળવાને રાહ જોવા કરતાં તે ખાતાને માતખર કરવાને આવતા યાત્રાળુ કારખાને ધર્માદો ભરવા આવે લારે તેવા દુષ્ટતાં ખાતાં તરફ પ્રથમ લક્ષ્ય ઐંચલું એજ માર્ગ અમોને તુર્તમાં જરૂરો બેવાય છે.

તાજુથી એછે કે આપણ્ણા વડીલો તેવા પાંચ ડુપિયા સુધીના વાંચિક હકકો ભરપાય કરતા હતા લારે અત્યારે ચાર આનાનો ટેક્ષ શરૂ કરવામાં પણ વર્ષોથી વિચઃર થાયછે આ સંઘળા જમાનાના ફરારેર માટે આગેવાન શહેરેને વધારે જવાણદાર કહી શકાશે. કેમકે અત્યાર સુધી કેન્દ્રનસ આગેવાન શહેરમાં ભરાયેલી છે લારે તેમાંના ડેઈ પણ શહેરો અથવા તેવાં બીજાં મુખ્ય શહેરેના આગેવાનોએ અને શાંઘ સમસ્તો મળોને ચાર આનાની યોજનાનો પોતાના ગામ માટે સ્વીકાર કર્યાનો એક પણ દાખલો જાહેર દાખિએ નોંધાયો નથી. આ પ્રમાણે પ્રાચિન ઇતિહાસ રણુ કરતાં વચે સુચના સંબંધે વિશેષ બોલી શકીશું નહિ તો પણ એતો ખરુંજ છે કે નાના ગામો અને સાધાર વર્ગ મોટાઓની પાછળ દોરાનારા છે અને તે પ્રમાણે અત્યાર સુધી ભાવે કે કલાવે દોરાતાજ આવેછે લારે સોગરણે પાણી ગળનાર ચુસ્ત વર્ગ કંઈ પણ શરૂ શરૂઆત કરવામાં પછાત છે તેમ એદ સાથે કહેવા જિવાય ચાલી શકતું નથી.

પાંચમો ઠરાવ પાલીતાલ્યાની ધર્મશાળાની ફરીયાદ સંબંધેનો છે કે જે પણ એછો અગત્યનો નથી. પાલીતાલ્યાની ધર્મશાળામાં સગવડની ગેરહુાજરી માટે આ પ્રમાણે લાંબા વખતથી ફરીયાદો શરૂજ છે અને તે અરખામાં જઈનોજ નહિ પરંતુ સાંધુ અને

સાધવીજુઓને ઉત્તરવા હેવામાં પણ છતા સાધને થતી અડચણુના બનાવો પ્રકાશમાં આવી ગયા છે. આવી અગવડો ટાળવા જઈન કેંચેસે પ્રથમજ ધ્યાન ખેંચવા જરૂર વિચારી હતી અને તે સ્વાલ ગયા વરસમાં પણ પુષ્કળ ચરચાઓ હતો કે જે પછી અપવાદ દાખલ કેાદ કેાદ ધર્મશાળામાં કંઈક બંદોભસ્ત થયાનું કહેવાય છે. પરંતુ જ્યાંસુધી ધર્મશાળાના બંધાવનારનો આશય સંપૂર્ણ અંશો ફળીભૂત થાય તેવા ધોરણે કામ લેવાનું વિચારવામાં આવશે નહિ. એટલુંજ નહિ પરંતુ તે પ્રમાણે પ્રમાણિક પણે વર્તતન થાયછે કે કેમ ? તેની સુનીમો ઉપર દેખરેખ રાખવા માટે શેડ આણુંદળ હવ્યાણુની હુસ્તક અથવા તો યોગ્ય કિમિટિ ઉપર ફરજ નાંખવામાં આવશે નહિ જ્યાંસુધી સદરહુ ફરીયાદ સંપૂર્ણ અંશો ફર થવાની ઓધીજ વડી રાખી શકાય છે.

સાતમો ઠરાવ ણહુજ આવશ્યક અને ચાલુ કોન્ટરસે ઉપાડી લેવા જોગ છે કે જે તિર્યો વહીવટ રીતસર અને ધારા ધોરણે ચલાવવા સંબંધેનો છે. આપણું પ્રાચિન દ્રચ્ય કહો કે અવિષ્ય સુધારવાનું શાંત સ્થાન ગણો પરંતુ કિમતીમાં કિમતી અજનો તિર્યો છે તેની સુધારણા અને સુચચવસ્થા રાખવાનું કામ જર્ણોદ્વારથી પણ વધારે અગલ્યાનું માનીએ છીએ છતાં ઐદની વાત છે કે અલ્યારે આપણી તિર્ય ભૂમીઓની દેખરેખ; વ્યવસ્થા અને પવિત્રતાની જળવણી માટે ફરીયાદ કરવાના કારણો પ્રતિદિન ઘટવાને બદલે વધતાંજ જોવાય છે. સમેતશિખરના નજીકના દેખરેખ રાખનારાને સરકાર પાસેથી માનપાન જોઈએ છીએ. શ્રીઆણુજીના વ્યવસ્થાપકો સત્તાની શૈકુમાં દળાં ગયાણે. ગીરનારજીના ગવરનરો ગુંચવણુમાં પડ્યા છે અને તે સાંચવવા શક્તિ નથી તેમ મુકવા મરજ નથી તેવું છે. ધણું તિર્યો નજીવી દેખરેખ નીચે નલે જાયછે. અને તે રીતે આપણી પવિત્ર ભૂમીઓના રક્ષણ માટે અલ્યારે તો નધણીયાતી મામદો થઈ પડ્યો છે. અને કહેવાની જરૂર જોઈએ છીએ કે આ પ્રમાણે હું વધારે વખત ચલાવવા હેવું તે પાછળ પસ્તાવા જેવું

છે અને તેથી આવતી ફોંડરન્સમાંજ તર્થી રક્ષણુ માટે ખાસ કમિટી ( સર્વ માન્ય સંસ્થા ) ઉલ્લિ કરવા જરૂર વિચારવી જોઈએછે.

### સમાધીનો સમય, મુનિગણુની મદદ.

અમદાવાદ કેંચેસના ઠરાવોના સંખંધમાં વિચાર કરવા પછીનો છેદ્વો ઠરાવ કે કે બીજુ ફોંચેસ મુંબધમાં ભરવાનો હતો તેના માટે વિચાર કરીએ છીએ ત્યારે આપણી અર્દ્ધદર્શ કેળવણી તથા ધરણાળુ તેમજ અજ્ઞાન તે વખતની સ્થિતિ માટે ખેદ થાયછે. કેમકે મુંબધની જઈન પ્રભાયે બીજા વર્ષમાં પોતાને ઘેર સલા ભરવાના વિચારથી કમિટીએ નીમી હીલચાલ કરવા પછી અમદાવાદના વીશા શ્રીમાળી ભાઇએને ફોંચેસ માટે તે વખતે હજુ ખ્યાર ઉત્પન્ન નહિ થવા પામેલ હોયને તે ખખર મુંબધ જતાં ઉપરોક્ત હીલચાલ ત્યાંજ અદકી ઉડી અને આ રીતે ફોંચેસ કહોકે જઈનોની મહાસલા ચુમાધીમાં પડી.

કેમના જિતસાંહી હિતચિંતકોને આ સમાધિસ્થ દિશા અનુકૂળ જણાઈ નહિ. તેથી હવે ડેવી રીતે કામ કરવું તેની શ્રીકર થવા લાગી અને મી. દૃઢાએ આવો મેલાવડો તર્થી ભુમીમાં કરવાનો વિચાર પોતાના મનમાં ઘડી કાઢ્યો. કેમકે તર્થી સ્થળોમાં યાત્રાએ પણ જૈન સમુદ્ધાય સારી સંખ્યામાં એકત્ર થાયછે. અને તેથી હવે તે રીતે પ્રાચીન ઉદ્દેશનો પુનરોદ્ધાર કરવાનુંતે એક પગથીયું હતું. તેને માટે કયું તર્થી પસંદ કરવું તે સ્વાલ આવી પડ્યો. કાર્ય એ પ્રકારનાં હતાં પ્રથમ તો સુમાજ વિચાર કેળવી કેમના સંમેલનના ફ્રાયદા તરરુ. બોક. દાષ્ટ એંચી પછી રહ્યાંકો જિતપણ કરજાના હતા અને તે પછી કામ લાધુન ઉપર મૂકવાનું હતું. આદતમાટે દૃઢાએ પોતાના માંતમાં અનુકૂળ તર્થી સ્થળ પસંદ કરતાં રેલવેની ખાસ સગવડ ખરાવનારું તર્થસ્થળ શી ફ્રોલ્યુદી દર વરસ ભાડરવા વડી ૮-૧૦ યાત્રાળુંએ. મોટી સંખ્યામાં આવતા હોયને ત્યાંજ પ્રથમ મેળાવડો કરવાનો વિચાર કર્યો. પરંતુ હવે સમાજત્તમ મત એકડ

કરવાનું કામ આવી પડયું. તેમજ ત્યાં હૃજર થતાં વિચાર સમજ પ્રિય કરવાનું થીએ તરફથી ચાલ્યું કે જેમાં અજમેરના વલિ શોઠ ધનરાજજ કાંસટીયા વગેરેને સમજાવી સહાયક તરીકે તૈયાર કર્યા. અને સંવત ૧૮૫૬ના મેળા પ્રસંગે “ શ્રી ઇલેણ્ડી તિંથોન્નતિ સલા ” નામની સંસ્થા સ્થાપન કરી, તેનું કામ રિંધ રક્ષણ અને સગવડ સાંચવવા ઉપરાંત મૈત્રી ભાવ વધારવા અને અરસ્પરસ વિચારાનો વિકિય કરવાનું રાખ્યું.

આ રીતે સ્થાનનો પાયો સ્થાપીત કરવા પછી મી. ઢૂઢુએ ગુજરાત કાઠિયાવાડમાં પોતાની સફર શરૂ કરી અને અનુકૂમે વડનગર, પાટણ, અમદાવાદ, લાબનગર, અને પાલીતાણમાં યાત્રાણું વચ્ચે ડેંનફરસના ફાયદા સમજાવતાં દરેક સ્થળેથી તે વિચારાને સમત્તિ મળી. વધારે ખુશીનું કારણ એ મજયું કે. આ પ્રમાણેની સમત્તિ આપવામાં તેમજ અપાવવામાં મુનિમહારાજે તરફની પણ સારી સહાય મળી અને તે પ્રમાણે આ અરસામાં મુનિમહારાજ શ્રી વીરવિજયજી, મુનિરાજ કાંતિવિજયજી, મુનિરાજ નેમવિજયજી, મુનિ શ્રી દાનવિજયજી, મુનિશ્રી મણિવિજયજી, મુનિશ્રી કર્ષેરવિજયજી મુનિશ્રી ડેસરવિજય, વગેરેએ શ્રાવક વર્ગને સમેલનના લાલ સમજાવવા ઊપરાંતુંપાલીતાણમાં મુનિમહારાજ શ્રી દાનવિજયજીનું પ્રમુખ સ્થાન તથા લગભગ દોઢસો સાંધુ સાધબીની હાજરી વચ્ચે ચતુરવધ શાંઘનો મેલાવડો કરી મહા સલાની જરૂરીઆત દર્શાવવામાં આવી. જયારે પંડીત લાલનને પણ તેવા વિચારો ઘોળાયા કરતા હતા તેને માર્ગ મળતો નેથી તેણે પણ હાજરી આપી સ્વામી લાઈએ સમજાવવામાં સહાય કરી. આટલો યત્ન કરવા પછી વધારે કામ પોસ્ટની મહદ્દી ચાલ્યું અને મી. ઢૂઢુએ રજુતાના, માળવા, પુર્વ પ્રદેશ ( અંગાળ ) પંબણ. ગુજરાત, કચ્છ, કાઠિયાવાડ; મુખ્ય અને દક્ષિણ માંણેના મુખ્ય સ્થળોના અયગણ્યના સમત્તિપત્ર મંગાયા, ને ઉત્સાહી મેંબરો શોઠ પુનમચંદજ સાવધનું, મહેતા અખતાવરમલજ, શોઠ હીરાચંદજ સચેત વગેરેનો મત મળતાં

પુન: પહેલી મહા સંક્ષાનો દિવસ સં ૧૯૫૬ના ભાદરવા વહી ૯-૧૦ તા. ૨૫-૨૬ સપ્ટેમ્બર જન. ૧૯૦૨ ઠરાવી શ્રીકૃલોધી તિર્થ રક્ષક સમા તરફથી છિંદના દરેક લાગમાં વર્તમાન પત્રો માર્ગીત તથા પોસ્ટ માર્ગીત જુદી કુમ કુમ પત્રીકા મોડલવામાં આવી. અને આ રીતે એક સપ્ત ઉત્સાહી શખસના ધનથી નહિ પણ તન મનના યત્ને વર્ષોની મહેનતના અંતે પણ આશાના અંકુરો ઉત્પત્ત કર્યો.

જૈન કેંદ્રન્સને નામે પુનરજનમ.

અનુકૂમે જામેવનનો દિવસ નજરદિક આવતાં યાગાળુઓને ડેલી-ગોટાથી મેરતાદોડ સ્ટોશન તથા ઇલોધી હુલમદી રહ્યું. અને નિયમસર તા. રૂપમીએ જેધપુર નીવાસી મહેતા બખતાપરમતાજીના પ્રમુખપણું નીચે મેળાવડો તૈયાર કરેલા સમિયાણુમાં એકડો મજદો. પ્રસંગોપાત કંહેલું જેધાં કે આ મેળાવડામાં એક જાગમની રાખવામાં આવી હતી.

## પ્રથમ કેંદ્રન્સનો રીપોર્ટ.

કાર્યની શરૂઆતમાં આવકાર દેનારી કમિટીના પ્રમુખ અનુમેરવાગી શોડ હીરાચંદળ સચેત તરફથી મી. દાદુએ લાખથુ આપતાં જધન કેમનો મોટો જથો એશવાગ કેમની ઉત્પત્તિ મારવાડના ઈચ્છા નગરમાંથી થઈ છે. તે મર્યાદ પ્રદેશમાંથી કેંદ્રન્સનો પાયો નાંખવા માટે અને સૌની હાજરી માટે સંતોષ જહેર કરતાં જાણાંયું કે જધન કેંદ્રન્સ એક દિવસ યા એક વરસ અને એક મનુષ્યના યતનું ક્રૂણ નથી પરંતુ વરસેના યતનું ક્રાગેલે. તિર્થીકર લગવાન જ્યારે વિચરતા હતા. ત્યારે દેવ દેવીઓ સાધ સાધવી અને શ્રાવક આવિકા આદીથી તિર્થચર્ચાયેત સર્વે એક સ્થાને એકગ થઈને દેશના સાંભળતા હતા અને તેઓમાં એ પ્રસંગે પરસ્પર પ્રીતિ વધતી હતી એટલું જ નહિ પરંતુ એ રીતની એકત્રતાથી ધર્મકાર્યમાં દરેક પ્રકારે સરકતા અને સુહદતા વધતી હતી. વળી છ-રી પાળતા જાંખ નીક-

ળવાનો ઉદ્દેશ પણ એ હુતો કે જેને ગામમાં કે શહેરમાંથી સંઘ પસાર થાય તેતે ગામના સંઘ સાથે પરસ્પર પ્રીતિ વધવા સાથે જીનમંદીર તથા જીનપ્રતિમાળ અને ધર્મશાળાઓ વગેરેની સ્થિતિ માલુમ પડતાં તેમાં અતુકુળ સુધારો થઈ શકતો. વળી આ પ્રસંગમાં મોટા રાજ મહારાજ અને રાજમંત્રી ધર્મરક્ષામાટે સતત થત્ન કરનારા હતા, પરંતુ અત્યારે સમય એવો આવી ગયો છે કે તેવા પ્રતાપી મહાનુભાવ આર્ય કે જઈન રાજ મોણુદ નથી તેમ તેવા સંખ્યાબંધ ધનાદ્ય શોઠ શાહુકાર કે રાજમંત્રી જોવાઈ શકતા નથી. અને તેથી આપણું સૈંને એકત્ર થવાના વિચારથી કામ કરવા જરૂરછે, વિચારને વિકૃય તે કિમતી લાલછે. એકેક કંકરાથી ગઠ અનેછે અને એકેક ઝીંદુ પાણીથી સસુદ્ર લરાયછે તે પ્રમાણે એકત્ર મળીને આપણી જાતિ અને ધર્મની ઉત્ત્રતિ કરવાના વિચારો કરવાની ખાસ જરૂરછે.

ત્યારખાદ તેમણે જ્ઞાન લાડારો ખોલાવી તેનો ઉદ્ધાર કરવા તથા ચૈત્યોદ્ધાર કરવાના વિચાર કરવા આગ્રહ કરતાં પ્રતિમાળની આવશ્યકતા સમજાવી તેવાં અપૂર્વ મંદ્વિરોની લાખો ખંલકે કરેડોની મીલિકતાની સાર સંભાળ કરવાની ફરજની યાદ આપી હુતી.

વળી આગળ વધતાં હેમચંદ્રાર્ય પાટણમાં પદ્ધાર્યા તે વખતે સામૈયામાં ૧૮૦૦ કોટાધીપતીઓ હતા તે જમાના સાથે આજની સ્થિતિ સરખાવી એદ દર્શાવતાં હાલ જઈન કેમની આખા હિંદુસ્તાનમાં એકપણ હાઈસ્કૂલ કોલેજ કે એડીંગહાઉસ કંઈ ન હોવા માટે ધ્યાન એંચ્યું હતું.

સંપની આવશ્યકતા માટે બોલતાં કહું કે-સંપથી નાના નાના પણ મોટાં કામ કરી શકે છે. દાખલા તરીકે હું ખર જેવી નાકી કોમે એકતાથી અલીગઢ કોલેજ તથા અદહાખાદમાં એડીંગહાઉસ વગેરે સ્થાપેનેછે. વળી આર્ય સમાજસ્ટોઓ લાહોર કોલેજ માટે ચોખ્ય ફૂંક ઉત્પન્ન કરેલ છે.

આ ઉપરાંત મુનિવરેના વિહારની દિશા સર્વ હિસી કરવા તેમજ

નિરાશ્રીત અને નિરુદ્ધમી સ્વામી ભાઇઓને માટે સહાય કરવા ભલામણું  
કરી પોતાનું લાખથું ખતમ કીધું હતું.

તેમના પછી પ્રમુખે પોતાના લાખથુમાં સંપ તથા કેળવણીની  
આવશ્યકતા તરફ લક્ષ ખેંચી તિર્યોની આશાતના હુર કરવા તથા  
જઈન ઇંડોના હીસાબ ચોખ્ખા રાખવા ભલામણું કરી તેજ રાતે તથા  
બીજે દિવસે નીચેના ઠરાવો પસાર કરવામાં આવ્યા.

૧ આ સભાનું નામ જઈન કોન્ફરન્સ રાખવું.

૨ આ પ્રમાણે આ કોન્ફરન્સનો મેળાવડો હર વર્ષ અતુકુગ  
સ્થળે ચાલુ રાખવો.

૩ આપણી જઈન કોમ કેળવણીમાં બહુ પાછળ છે તો તેમાં  
આગળ વધારવા આગેવાન અહુસ્થોએ ચોખ્ય પ્રયાસ કરવો જોઈએ.

૪ વ્યવહારિક શિક્ષણીની સાથે ધાર્મિક શિક્ષણ આપવાને શરૂ  
કરવાની આવશકતાએ સખબ તે માટે ચોખ્ય યત્ન કરવાની જરૂરીયાતએ.

૫ નિરુદ્ધમી તથા નિરાશ્રી જઈન બનધુઓને સહાય આપવા  
માટે ચોખ્ય ગોઠવણું થવી જોઈએ.

૬ જેણે તિર્થ અને છુટક હેરાસરળ જરૂર સ્થિતિમાં આવી  
ગયાં છે. તેનું એક દીસરું તૈયાર કરી પછી તેના જણાદ્વાર માટે  
ચોખ્ય યત્ન થવો જોઈએ.

૭ ઇલોધી તિર્થના માંદિર વગેરેમાં જે ગેરળાંદોબસ્ત અને  
આશાતનાએ તેને માટે આ કોન્ફરન્સ દલગીની સાથે નોંધ લેછે.  
અને આશા રાખેછે કે આ તિરથનો ડિસાબ ઇલોધી તિરથોજની  
સભાં મેરતાના અહુસ્થો સાથે સમજ તાકીદે પ્રસિદ્ધ કરશે તથા  
આવકમાંથી મંદીરનો રંગ રીપેર કરાવશે.

૮ જયાં જયાં આપણા પુસ્તકોના બંડાર હોય લાંના પુસ્તકોની  
દીપ તેની અલ્યારની સ્થિતિ સાથે આ કોન્ફરન્સ તરફથી તૈયાર  
કરાવી છપાવી જોઈએ.

૯ પવિત્ર તિરથો પર જે આશાતના અને ગેરવ્યવસ્થા થાયએ  
તેને જહેરમાં લાવી અટકાવવા માટે ચોખ્ય પ્રયત્ન છરવા જરૂરએ.

૧૦ જૈન કોમમાં ચાલતા હાનીકારક સંસારીક રીત રીવાજેમાં સુધારો કરવાને યોગ્ય પ્રયત્ન કરવો જોઈએ. તે રીવાજેની તપસીલ.

અ-વહેભી માનતાઓ અને મિથ્યાત્વ સેવન.

અ-લગ્મમાં અધિત ખર્યો અને વેશ્યા નાચ.

કુ-મરણુ પણીનું બેશરમ રોવું કુટવું અને જમણુ.

ડ-અગરણીમાં જમણુ અને પ્રણ લોજન.

ઇ-કન્યા વિકુય, ખાળવણ, વૃધ્ય વિવાહ અને એક કરતાં વધારે સ્વી કરવાનો રીવાજ.

ઝ-દાર્ઢ પીવાની પેસી ગાંધેલી રસમ.

ગ-જમાદિ સંસ્કાર વિધિ મિથ્યાત્વી થાયછે.

આ રીવાજેમાં સુધારો થવા જરૂરછે.

૧૧ કોન્ફરન્સનું કામ કાજ ચાલુ કરવાને જનરલ સેકેટરી તથા પ્રાંતિક ( પ્રોનીનશીયક ) સેકેટરી સુકરર. કરવા ( આ પ્રસંગે વધારો ઘરાડો કરવાની કોન્ફરન્સની સત્તા સાથે પ્રાંતવાર સેકેટરીઓ ચુંટી કાઢવામાં આવ્યા હતા )

૧૨ આવતી ખીજુ કોન્ફરન્સ પાલીતાણે અનુકૂળ વળતે ભરવી.

પહેલી કોન્ફરન્સના ચુંટાએલા પ્રોવીન્સીયક સેકેટરી.

મુંખું ઈલાકો—સુંખું શેડ ઇકીર્યંદ પ્રેમચંદ રાયચંદ જે.પી. શુજરાત—ચામદાવાદ શા. મોતિલાલ કશળચંદ.

કાઠિયાવાડ—ભાવનગર હોરી કુંવરજી આણુંદજી.

દક્ષિણ—પુના શેડ નાનચંદ લગવાન.

જવાલીચેર શેડ નથમલજી શુદેંછા.

માળવા—ઇ.દોર શેડ લક્ષ્મિચંદજી સીઆણ્ણી.

પંજાણ—લાલોર ભી. જસવંતરાય જઈની.

ખંગાળા—કલકત્તા અવેરી મોતીચંદ લાલચંદ.

શેડ જેઠાલાઈ જયચંદ.

જયપુર શાહ સુજણ મલજી લદવાણી.

મારવાડ—નેથપુર પારેખ દીપચંદજી.

રજપુતાના—અજમેર શેડ હીરાચંદજી સચેતી.

મેવાડ—ઉદ્યપુર પૂળવત મગનલાલજી.

### ભીજુ કોન્ફરન્સ અગાઉની હીલચાલ.

ઉપર નેથ ગયા તેમ પહેલી કોન્ફરન્સ પ્રસંગે ભીજુ કોન્ફરન્સ પાદીતાણે ભરવાનો ડરાવ કરવામાં આવ્યો હતો. પરંતુ પાદીતાણાના ડાકેાર જાણે તે અરસામાં વાંધે. ઉડવાથી તથા તિર્થસ્થળોમાં આ મેગાવડો કે જેમાં તન મન અને ધનનો પુષ્કળ લોગ આપવો નેછાએ તે ઇરજ ઉડવનાર તેવા સ્થળમાં ભાવ્યેજ નીકળી આવવાની વકી સબળ ભીજુ કોન્ફરન્સનો મેગાવડો બનતાં સુધી આગેવાન શહેરમાં કરવા માટે નિયાર ચલાવવા પ્રાંતિક સેકેટરીએ તથા પીજા આગેવાન અહુસ્થોની એક મિટિંગ તા. ૧૨૬મી જુન. સન. ૧૯૦૩ના રોજ અમદાવાદમાં શેડ નેર્સીગલાઈ હુઠીસંગના પ્રમુખ પણ્યા નીચે મળી તેમાં છેવેટે ભીજુ કોન્ફરન્સ સુંબદ્ધ લઈ જવા કરાવ થયો. અને આ રીતે પુર્વે અમદાવાદમાંથી ભીજુ કાંચેસના નામે સ્થપાએલ મહામલાને સુંબદ્ધએ કરેલું આમંત્રણ તેજ સ્થાન માંથી પુનઃ ઉપાડી હેવામાં આવ્યું. અને તા. ૨૪ જુલાઈના રોજ મુનિમહારાજશ્રી મોહનલાલજી મહારાજના પ્રમુખપણ્યા નીચે સુંબદ્ધના શાંઘપતિ શેડ રતનચંદ ઝીમચંદ મોતીચંદ તરક્ખથી કંચ્છી વીશા ઓશવાળ જાતિની મહાઅન વાડીમાં સુંબદ્ધના શાંઘને એકત્ર કરી એહુઝર શ્રાવક શ્રાવકાની હાજરી વર્ચ્યે હાથ ધરેલ કાર્યને સાંગેપાંગ કેમ પાર ઉતારવું તે માટે નિયાર ચલાવવા તથા કોન્ફરન્સનો અર્થ તથા હેતુ અને એકતાની પુષ્ટીના વિદેશ સમજવવા પછી સુંબદ્ધમાં વરતા ચુજરાતી, કંચ્છી કાઢિયારાડી, મારવાડી, દક્ષિણી વર્ગેરે દરેક કોમના આગેવાન મેંબરો ચુંટી રીસેપ્શન કુમિટી નીમી કર્યાની શરૂઆત કરવામાં આવી અનેહરેકના સતત યત્ન અને મોટા ઉત્સાહ વર્ચ્યે કોન્ફરન્સનો મેગાવડો જાંવત ૧૯૦૪

ના ભાદરવા વહી. ૧૩ ૧૪, ૦)) તા. ૧૯-૨૦-૨૧. સરેન્ટોર  
 ૧૯૦૩ વાર શાની, રવિ, સોમના રોજે કલકત્તાવાળા બાધુ  
 રાયઅદ્રીદાસજી સુકીમ બાહારના પ્રમુખ પણું નીચે કરવામાં  
 આચ્છે. કે જેઓ મધ્યીજના કેસ તથા સમેત શીખરપરનું ચરણીનું  
 કારખાનું કઢાવી નાખવવાના કામ માટે અને બાગાળામાં જઈન  
 સ્વાલ માટે સારો ભાગ લેતા હોવા સાથે નામદાર વાયસરાયના  
 ખાસ અવેરી હોયને રારી રીતે જાણીતાછે. વળી આ મેળાવડામાં  
 આવકાર હેનાર કમિટિના પ્રમુખ તરીકે શેડ વીરચંદભાઈ દીપ-  
 ચંદ. સી. આઈ. ઈ જે. પી. તથા ચીફ્સેકેટરી તરીકે મરહુમ  
 મહુન નર શેડ એક્સિચંદ પ્રેમચંદ બજારનું હતું જ્યારે પેટ્ર  
 કમિટિઓના કામકાજ માટે નીચે પ્રમાણે નેમં નોક કરવામાં આવી હતી.

.. કમિટિ.	પ્રમુખ	સેકેટરી.
ઇન્ટેલીજેન્ટ હેઠથ શેડ અંભાલાલ બાપુભાઈ. મી. અમરચંદ પી. અને વોલીયંટીઅર.		પરમાર.
ઉતારકમિટિ. અવેરી કલ્યાણચંદ સોલાગચંદ મી. અભ્રતલાલ કેવળદાસ કેરસપોન્ડ-એક્સિચંદ મી. લખમસી હીરજીમેસરી મી. મોહનલાલ પુંજલાઈ ઇંડ કમિટિ. ડેન્ડ નહીં. શેડ ત્રીલેલાનદાસ બાષુજ લોજનકમિટિ શેડ બાલચંદ કનીરામ મી. મોહનલાલ હેમચંદ મંડપ કમિટિ રા. આ. માણેંકચંદ કપુરચંદ મી. છાટાલાલ પ્રેમજી મી. દેવકરણ મૂળજ હીસાખ કમિટિ. શેડ ટોકરશી શ્યામજી મી. સુળચંદ હીરજી જનરલ સુપરવાઈઝર શેડ માણેંકલાલ ઘેરાભાઈ		

આ પ્રમાણે કમિટિઓ ચુંટી કામ વહેંચી કેવાથી બીજ  
 કેન્દ્રનસ બાહુ આર્કષણીય થઈ પડી હતી. અને તેથી તેનો લાભ  
 સેકડો ગ. મેના હુલરો-ટેલીગ્રેટો અને વીઝીટરોએ લીધો હતો  
 સાથમાં સી. વીઝીટરે પણ મોટી સંખ્યામાં ત્યાં હાજરી આપવાની  
 શકૃઆત કરી હતી કે જેને માટે ખાસ મરહુનવાળી એઠક રાખ-



રાયખાલાદુર બદ્રીહાસળ સુકિમ.  
મુંબઈ-ખીલ નૈન થેતામથર કોન્ફરન્સના પ્રેસ્ટીડન.  
કલકતા.



વામં આવી હતી આવેલ ડેલીગેટોમાં ૫૪૫ અમદાવાદ સર્કલ.  
૨૪૬ સુરત સર્કલ, ૩૨૫ કાડિયાવાડ, ૧૨૫ રજુનુતાના ૧૨૦ પંબાળ  
૧૮૦ ઇશ્ટાણું અને ૮૮ બાંગાળના હતા,

ખુરી થવા કેવું છે કે આ પ્રસંગથી આવા મંડળના લાભ  
જહિન યુવકો પણ ચારી રીતે સમજવા લાગ્યા હતા અને તેથી  
અહુસ્થ અને વિદ્ધાન યુવકોએ વોલીઅંટીયર (પટાવાળા) તરફે  
શ્રીસંધની જક્કિત કરવાને મેટી સંખ્યામાં ઉમેદવારી કરી હતી,  
અને તેનો સ્વિકાર થતાં કામ ધણું સરલ થઈ પડ્યું હતું. વળી  
આ ઉપરાંત સ્વાગત વગેરે માટે પણ વખાણુવા જેગ સારી રીતે  
બાંદોબસ્ત કરવામાં આંદોલા હતો અને દરેક રીતે ફાંનેરસનું કાર્ય  
બનિધને માટે સરલ તેમજ સર્વ પ્રિય કરવાને દરેક પરિશ્રમ  
સહન કરવામાં આવેલ હતો.

અંબર્ધના જૈન ભાઇઓએ આ ઉપરાંત ખર્ચને માટે પણ ચારી  
મદદ આપી હતી તે એટલા ઉપરથી જોઇ શકાશે કે જુદા જુદા  
અહુસ્થો તરફથી લોજન ખર્ચ ઉપાડી લેવા ઉપરાંત પરચુરણ ખર્ચ  
માટે મળેલી રકમમાંથી ઉદાર રીતે કુલ ખર્ચ થવા પર્છા પણ લાની  
કભિનના હુસ્તક લગભગ દરી હુસ્તર રૂ., ખર્ચ્યા હતા. વળી કોન્ક-  
રન્સ પ્રસંગે થએલા ભાષણુની અસર થતાંજુદાં જુદાંછ ખાતામાં કોન્ક-  
રન્સમાં હોજર રહેલાઓએ તેમાં ફર્ડ નહિ કરવા વિચાર  
છતાં ઉત્સાહથી નીચે પ્રમાણે રકમો ભરી આપી હતી.

૧ પુસ્તકોદ્ધાર ખાતામાં	રૂ. ૧૬૧૬૬
૨ લુંબોદ્ધાં ખાતામાં	રૂ. ૨૦૧૬૭॥
૩ નિરાશીત ખાતામાં	રૂ. ૨૪૭૫૮ ૩૩
૪ લુંવ દ્યાના ખાતામાં	રૂ. ૧૭૨૮૮।
૫ કેળવણી ફર્ડમાં	રૂ. ૧૮૭૧૬।
૬ કોન્કરન્સ નીભાવ ફર્ડમાં	રૂ. ૧૮૭૪૬

૧૧૮૮૪૫॥

આ અમાણે થયેલા ભાપણો દરમિયાન લગભગ રૂ. એકલાખ ઓગણીશ હુલર રૂપિયા જેઠલી મોટી રકમ ભરાઈ જતાં કોન્ફરન્સનું કામ મકમ પાયા ઉપર આગળ વાગરવા તક મળી હતી. કે જેણી વાયરથી સંબંધમાં હું પછી જણ્ણાવીશું. પરંતુ તે પૂર્વે

### બીજુ કોન્ફરન્સમાં થયેલું કામકાજ

આપણે તપાસીશું. કોન્ફરન્સમાં જે ઠરાવો થયા હતા તેમાં ઉપકાર વગેરેના સામાન્ય વિવેક દર્શાક ઠરાવો જવા દઈએ તો નવા ઠરાવોની સહજ વૃદ્ધિ સાથે પ્રથમ કોન્ફરન્સના ઠરાવોને વધારે સરલ રૂપમાં પુનઃ તાજી કરવામાં આવ્યા હતા તેમ જોવાય શકેછે. પરંતુ પ્રથમ કોન્ફરન્સ પ્રસંગે નામ પણ નહિ જણુનાર મોટો ભાગ આ પ્રસંગે કોન્ફરન્સનું ખરું સ્વરૂપ જણ્ણાવા ભાગશાળી થયેલ હોયને તે ઠરાવો નવા જેટલાજ પ્રિય થઈ પડ્યા હતા. આ ઠરાવો પસાર થવા પૂર્વે આવકાર હેનારી કમિટીના પ્રમુખ શોઠ વીરચંદભાઈ એ ભાવણું આપેલ તેમાં કેટલોક ભાગ ખાસ અભ્યાસ કરવા જેવો છે કે જેમાંથી કંઈક આ તકે જાહેરમાં મૂકીશું. તેમણે આવકાર આપતાં પોતાનો આનંદ કોન્ફરન્સનું સ્વરૂપ અને ઠરાવોનું પૂર્વ સ્વરૂપ દર્શાવતાં જણ્ણાવેલું છે કે, “ આવા મેળાવડા આગળ એક જુદીજ પદ્ધતિ ઉપર આપણા જઈન તીર્થેમાં થતા હતા અને તેઓ શાંધને નામે ઓળખાતા હતા. શ્રી શાંધને પરીશમે તીર્થેકર કહેવાય છે. અને તેથી તેને શ્રી અરીહંત જેવા સમર્થ પણ નમોતિધ્યસ્સ કહી નમેછે. ( તેનું જમાના અનુકૂળ સ્વરૂપ ) કોન્ફરન્સ અથવા મહાન સભાનો હેતુ-એક સંપ થવાનો છે, આપણે એક સંપ થઈ રણ્ણસામના જઈ ચુદ્ધ કરવાનું નથી. આપણે સંપ કરીને કોઈનું રાજ્ય લેવું નથી. પણ એક દિવિથી સંપ કરી આપણું અને આપણા જઈન ભાઈનું ભલું કરવાનું છે, પવિત્ર જઈન ધર્મની ઉજ્જ્વલિ કરવાની છે, જાનલાંડાર તથા તિર્થેનું રક્ષણ કરવાનું છે. ધર્મના પવિત્ર નામને આપણા સદ્વર્તનથી દિપાવલાનું

છે. કુંકામાં જેથી આપણું આજવ પરખવનું હિત થાય, જેથી આપણુને મળેલા અમૃતય મતુષ્ય દેહનું સાર્થક થાય તેવી ચોજના સ્વીકારી તેને અમલમાં લાવવાનું છે. બંધુઓ બોલીને બેસી રહેવાનું નથી. પરંતુ જે જે કંઈ કહેવાય તેને અમલમાં મૂકવામાં આવે તેમ થવામાં આ મેળાવડાનું સાર્થક હોયને તે ડેવી રીતે અમલમાં મુકી શકાય તે માટે વિચાર કરવાને હું ધસારો કરુંછું.

તેમના પછી પ્રમુખ રાય બહાદુર બાળુ સાહેબ બદ્રીદાસ, મુશ્નીમે ભાષણું આપતાં દેવગુરુ અને ધર્મનું સ્વરૂપ સમજલવી કોન્ફરન્સના કર્તાવ્યનું લાન કરવનાર લંબાણું ભાષણું કરવા પછી નીચેના હરાવો પસાર થયા હતા.

### ( બીજું કોન્ફરન્સમાં ) થએલા ઠરાવોનો મુસદ્દો

૧ અંથોન્ઝાર—ગુજરાત મારવાડ દક્ષિણ આઢી દેશોમાં જુદે જુદે સ્થળે પરમેપકારી મહાન પૂર્વાચાર્યોએ રચેલા શાસ્ત્ર અંથોના આપણા ગ્રાન બંડારોછે. જે હિન પ્રતિદિન લુણ્ણાવસ્થાને પામતા બય છે. તેથી કરી તે અનુપમ શાસ્ત્ર અંથોની થતી આચાતના ફર કરવાં માટે તથા તેમના સંરક્ષણ્ણાંથે ૧ તે બંડારોના અંથોની ટીપ ૨ તથા તેનો લુણ્ણાદ્વાર જનતી ત્વરાએ કરવાની આવશ્યકતા આ કોન્ફરન્સ સ્વીકારે છે.

૨ બ્યાવહારિક તથા ધાર્મિક કેળવણી—ધર્મ પ્રમુખ ચારે પુરુષાંથે સિદ્ધ કરવાને શક્તિમાન થવા સારુ ચાંચી વર્જ અને પુરૂષ વર્ગમાં બ્યાવહારિક તથા ધાર્મિક હંચી કેળવણીનો પ્રચાર કરવા માટે તથા પ્રાથમિક કેળવણી પણ કેટલેક સ્થળે લેવામાં નથી આવણી તેને માટે—

- ૧ બની થકે તો ફરલુઆત પ્રાથમિક કેળવણી દાખલ કરવા તથા તેને માટેની રૂલો
- ૨ મોટાં શહેરોમાં હાઇસ્કૂલો

૩ પોતાની ગરીબ સ્થિતિને લીધે જાંચો અભ્યાસ કરતાં  
અટકી પડતા નૈન વિદ્યાર્થીઓ માટે બોડીંગો તથા ચોઅ  
ર્કેલ્ટર્શીપો.

૪ સંસ્કૃત તથા માગધી પાઠશાળાઓ.

૫ કુન્યા તથા આવિકા શાળાઓ.

૬ જૈન લાયઙ્ગનીઓ.

૭ વ્યાપાર સંખાંધી જ્ઞાન મેળવવામાટે વર્ગો તથા સ્કૂલો વિગેરે  
આતાં સ્થાપવાં અને

૮ ધાર્મિક વિષયોપર સસ્તું સાહિત્ય તથા વિદ્યા ભરેલાં તેમજ  
ઓધદ્દાયક લખાણોવાં જૈનપત્રો તથા માસિકો પ્રગટ કરવા માટેની  
એ કેન્દ્રનંસ ધર્માજી અગલ્યતા જુએછે. કેટલેક સ્થળો સારા પાયા  
ઉપર પાઠશાળાઓ તથા સ્કૂલો સ્થાપનામાં આવીછે તથા જૈન પત્ર  
અને માસિકો પ્રગટ થાયછે તે સંભળીને આ પ્રસંગે તેને માટે  
પોતાનો હુષ્ણ એ કેન્દ્રનસ જાહેર કરેછે. અને આવા કર્યેની સિદ્ધિનો  
ધનાદ્ય જૈનોની જાદારતા જીપર મુખ્ય આધાર હોવાથી એહી જરૂ  
રીઆતના માર્ગમાં પૈસા ખરચવાને બદલે વિદ્યાદાન જેવા પૂછ્ય કેત્રમાં  
પોતાના પૈસાનો સદ ઉપયોગ કરવાને લાવિક અહુસ્થેને આ કેન્દ્રનસ  
આસ ભલામણ કરેછે. તથા જુદે જુદે સ્થળો મોટા પાયા ઉપર આ  
ખાંખત સંખાંધી ઝેંડા ઉધારવાની એ કેન્દ્રનસ ધર્માજી  
આવસ્થાકૃતા વિચારે છે.

૩ નિરાશીત જઈનોને આશ્રમ—કેળવણીના તથા આશ્રમના  
અભાવે ગરીબ અને અનાથ જઈન અન્ધુચોની થતી કુઃખી  
અવસ્થા ફૂર કરવાને માટે.

૧ તેમને સારા ઉદ્ઘોગે લગાડવા.

૨ તેમને યથા શક્તિ દરેક પ્રકારની મહદ આપવા.

આનુકોન્ડરન્સ દરેક જધન બંધુને આગ્રહ કરેછે અને દરેક દેશવરોના આગેવાનો તરફથી આ ખાંખત ઉપર પુરતું લક્ષ આપવાની આ કોન્ડ્રરન્સ બહુજ જરૂર જુઓછે.

૪— જીવદયા આંહેસા પરમો ધર્મ. એ આપણા જધન ધર્મનો મૂળ સિદ્ધાંતછે તેથી કરી

૧ સર્વે જીવોની રક્ષા કરવી.

૨ તેમની હિંસા થતી હોય તે ચોઅય પ્રયાસ લઈ અટકાવવી.

૩ સારા બંધારણથી પાંજરાપોળ જેવાં દરેક ખાતાં સ્થળે સ્થળે સ્થાપવાં તથા ચોખવાથી ચ્યાવવાં.

૪ પશુઓ ઉપર ગુજરતું ધાતકી પણ અટકાવવા માટે ચોઅય ઉપાયો ચેઝવા.

૫ પ્રાણીઓના શરિરનાં અવયવોથી બનતી ચીને માટે પ્રાણીઓ ઉપર જુદી જુદી અને ધણીજ ઝૂરતા ગુજરેછે તેથી કરી તે બનાવાથી બનેલી ચીને ઉપયોગમાં ન લેવી.

૬ તથા તેવા અનેક ખીળ રસ્તો જીવદયા જેવા ઉત્તમ કાર્યોને ઉત્તોજન આપવાને માટે આ કોન્ડ્રરન્સ દરેક જધન બંધુઓનું ખાસ ધ્યાન ચેંચે.

૭ જીવ હ્યાના સંખ્યામાં જે રાખાઓએ તથા અન્ય દર્શાની અહુસ્થોએ પ્રસંશાપાત્ર પગલાં ભરેલાં હોય તેમનો તાર અથવા પત્રદ્વારા ઉપકાર માનવો.

૮—જૈન ડીરેક્ટરી—આપણા જૈન સમુદ્દરયની વસ્તી કેટલી છે. જીન મંહિરો જીનપ્રતિમા, જ્ઞાનકષાંડારો, પાઠ્યાળાઓ, પૂર્વાચાર્ય પ્રદ્ઘીત અંશો, જૈન સભા અને મંડળો, કેટલાં છે. તે વગેરે આપણા જધન સમુદ્દર સંખ્યાથી ઉપયોગી બાંખતની પુરતી માણેતી મેળ વવા માટે તેવી વીજતોથી ભરપુર એક ઉપયોગી અંશ (જઈન ફીરફટરી) તૈયાર થબાણી આ કોન્ડ્રરન્સ બહુજ આવસ્યકતા વિચારે છે.

૬—હાનીકારક રીવાળે દૂર કરવા તथા ભાતું ભાવ વધારવા ભાબત—આધુનિક મચલિત રીવાળે પૈડી (૧) મરણ પાછળ રડવું ફૂટવું (૨) મરણ પાછળ જમણવાર (૩) ધીન એટાં ફરજાત અર્થો (૪) કન્યાવિકુય (૫) અન્ય શાસ્ત્ર પ્રમાણે વ્યવહારીક કુયા કરવામાં આવે છે તે (૬) ણાજલગ્ર અને વૃદ્ધવિવાહ (૭) તથા આપણી કોમને અવનતીને રસ્તે લઈ જનારા તેવા ધીન હાનીકારક રીવાળે, જે જે દેશોમાં ચાલતા હોય લાં લાં તેમને બનતા પ્રયાસે સત્ત્વર ણાંધ કરવા, તથા આપણા સ્વધર્મિણનુંઓમાં વારંવાર થતો કુસંઘ અટકાવી એકુય તથા વિશેષ ભાતું ભાવ થાય તેવા સંગીન જિપાયો યોજવાને માટે આ કોન્ફરન્સ દરેક બન્ધુઓનું આ પ્રસંગે વિશેષ ધ્યાન એંચે છે.

૭.—જરૂરી જરૂરિ મંદિરોદ્ધાર—શ્રી સંપ્રિતિ મહારાજાએ કુમારપાળ આદિ પ્રતિષ્ઠિત રાજાઓએ તથા તે પહેલાં થચેલા રાજાઓ, અહુડશા, વિમળશા, વસ્તુપાળ, તેજપાળ, વગેરે મંત્રીઓએ, ધનારીશા, જવડશા, વગેરે શોહ શાહુકારોએ શ્રીજરૂરિન ધર્મ જયોતિના ચિરંકાળ પ્રકાશને માટે અઠળક દોલતના વ્યચે આ પંચમ કાળમાં આધારભૂત એવાં બબ્ય મંદિરો, તિર્યો, તથા શીલા લેખો અભિલાશારત વર્ષમાં જરો જરો કરાવેલાં છે. જેને આજે ધણો લાંખો વખત થઈ જવાથી તેમનો સત્ત્વર જરૂરોદ્ધાર કરવા માટે.

૧ જરૂરી થઈ ગયેલાં મંદિરો, તિર્યો અને પુરાતન લેખોનું  
લીસ્ટ કરવા

૨ તથા જુદા જુદા વિભાગોમાં સારાપાયા ઉપર જરૂરોદ્ધાર  
આતાં ઉધારવાની આ કોન્ફરન્સ ધણીજ અગટ્યતા વિચારે છે.

૮—ખાર્મિક ખાતાં તથા શુભ આતાંના હિસાબો રાખવા  
સુધીએ—

૧ આપણા જરૂરિન ધર્મનાં સાર્વજનિક ખાતાંઓ, જેવાં કે ટેવ

દ્રવ્ય, ઝપાન દ્રવ્ય અને સાધારણ દ્રવ્ય સંખ્યાખી ખાતાંએ બહુજ ચોખવટવાથાં રાખવાં.

૨ ખાદુ જમાનાને અનુસરીને તે ખાતાંએના આવક જાપકના હિસાબ અને સરવૈયાં પ્રત્યેક વર્ષે બરાબર તૈયાર કરવાં.

૩ અને ખની શકે તો તે ખાતાંએનો હિસાબ પ્રગટ કરવા માટે દુરેક શહેરના તથા ગામના જધન આગેવાનોને આ કોન્ફરન્સ ખાસ સૂચના કરે છે.

←સંવતસરીના તહેવાર સંખ્યા—આંગ્રેજ સરકારના રાજ્યમાં ભાડરવા શુદ્ધ ચોથના સંવતસરીના દિવસે જધન તહેવારની રજા નથી. તેથી તેઓને અરજ કરવાનું આ કોન્ફરન્સ ચોખ્ય ધારે છે. ને ઉપર ચોખ્ય ધ્યાન આપવામાં આવશે.

આ પ્રમાણે મૂળ્ય ઠરાવો કરવા જિપરાંત પાલીતાધ્વાના રાજ્યે કરેલી આચાતના માટે દલગીરીનો અને કાર્ય વાહુકો તથા રાજ્યનો ઉપકાર માનવાના ઠરાવો પણાર કરવામાં આવ્યા હતા. અને તે રીતે કાર્ય ક્રતેહુમંદીથી પાર ઉત્તારવામાં આવ્યું હતું:

જલ્લાવવું જોઈએ કે સુંખદિયે આ પ્રમાણે ઠરાવ કરીને સંતોષ માનવા ઉપરાંત કોન્ફરન્સ કાયમી નભી શકે અને તેના સંખ્યાધેના કાર્યથાં વિચારો કરવાને તક મળે તેટલા માટે તથા થએલ ઇંડની શું વ્યવસ્થા કરવી તે વિચારવા માટે પણ જરૂર જોઈ હતી અને તેથી તે થએલ ઇંડ માટે નીચે પ્રમાણે ઠરાવ કર્યો હતો.

ઇંડની વ્યવસ્થા ખાખત—આ જધન કોન્ફરન્સને લગતાં પાંચે ખાતાના ઇંડામાં ને રકમો ભરાઈ છે તેની તમામ સુડી એટલે મુળ મુદ્દુ રકમ તથા તેનું વ્યાજ પાંચે ખાતાના સંખ્યમા વાપરવા વ્યવસ્થા કરવા તથા ખર્ચ કરવા આ કોન્ફરન્સના ચારે કનરત સેટકેરીઓ (શેડ લાટબાઈ દલતપતભાઈ, શેડ ઇકીશ્વરંદ પ્રેમ-ચંદ, જે.પી. બાણુશાહ કુમારાસંહલ બદ્રીદાસલ), અને ભી. ગુલાબચ-

દ્વારા ) ને તેમના ચારેના એક મતથી અથવા તેમો માંના ત્રણના એક મતથી કરવા આ કેન્દ્રરંસ સત્તા આપે છે.

આ પ્રમાણે વ્યવસ્થાનો ઠરાવ કરવા સાથેજ.

કેન્દ્રરંસની ચોજના પારપાડવાના ઉપાય બાબત નીચે પ્રમાણે ઠરાવ કર્યો હતો.

૧ કેન્દ્રપણુ મોટા શહેરમાં વર્કિંગ ઓફિસ ઉધાડવા

૨ કેન્દ્રરંસ સંખ્યી ભાખી દેખરેખ રાખવામાટે એક વિદ્ધાન પગારદાર સેકેટરી નીમવા.

૩ જુદાં જુદાં મોટાં શહેરોમાં પ્રોવીન્સીઅલ સેકેટરીઓને બદલે નોઈટ સેકેટરીઓ નીમવા તથા તેમની દેખરેખ નીચે તે શહેરોમાં સ્ટેન્ડિંગ કમિટિઓ સ્થાપવા.

૪ જુદાં જુદાં ગામો તથા શહેરોમાં કેન્દ્રરંસ સંખ્યી હીલચાલ કાયમ રાખવા માટે વોલંટરી સેકેટરીઓ નીમવા.

૫ સ્ટેન્ડિંગ કમિટિએ કેન્દ્રરંસની ચોજનાઓ અમલમાં મૂકવા અને આસપાસના ગામોમાં જાયતી રાખવા સંખ્યમાં ઘર્યની વ્યવસ્થા પોતાના શહેરમાં કરી લેવા.

૬ પ્રત્યેક વર્ષ કેન્દ્રરંસની મિટિંગની એક માસ અગાજી નોઈટ સેકેટરીઓએ તથા વોલંટીઅરી સેકેટરીએ કેન્દ્રરંસ સંખ્યમાં થયેલા કામકાજનો પોતાનો રીપોર્ટ જનરલ સેકેટરીને મોકલી આપવા. તથા તેના ઉપરથી તૈયાર કરેલો રિપોર્ટ જનરલ સેકેટરીએ પ્રત્યેક કેન્દ્રરંસ વખતે વાંચી જવા.

૭ વિગેરે ભાખતો માટે ઉંચું બંધારણુ કરવા માટે ચાર વિદ્ધાન પ્રતિષ્ઠિત જનરલ સેકેટરીઓ નીમવા આ કેન્દ્રરંસ ધર્મીજ આવશ્યકતા વિચારેછે. તથા ત્રીજી કેન્દ્રરંસ ભરવા માટે સ્થળ અને વખત નક્કી કરવામાં આવશે. ( જેને માટે વડોદરા પસંદ કરવામાં આંદું હતું. )

આ પ્રમાણે મુંખઈનું કામ પુરું થવા પેછી ઓપણે છેલ્લે જોઈ ગયા તેમ બંધારણું અને વ્યવસ્થાના ઠરાવોનો ચાલુ અમલ કરવાને માટે મુંખઈમાં કાયમા એક્સિસ જોલી એક પગારદાર સેકેટરીની નેમનોક કરી ફરી ડાંડની વ્યવસ્થા તથા કામની વહેંચાણીનાં ચાર વિજાગ કરી નાંખી નીચે પ્રમાણે જોડવણું કરવામાં આવી.

૧ શેઠ ક્રીરચંદ્ર પ્રેમચંદ્ર ને. પીને રેસીડન્સી જનરલ સેકેટરી ફરાવી મુંખઈની એક્સિસનું કામ પણ તેમની હેખરેખ નીચે સોંપવા ઉપરાંત સુરતથી દક્ષિણે મુંખઈમુખીનો પ્રદેશ તથા આનદેશ બીરાર અને દક્ષિણ હિંદુસ્તાનને લગતું કામકાજ અને જીવ દ્વારા આતું તેમની હેખરેખ નીચે મૂક્યું.

૨ મી. ગુલાબચંદ્રલું દ્વારા ૨૭પુઠાના, મધ્યપ્રાંત અને માળવાને લગતું કામકાજ અને જરૂર પુસ્તકોદ્વાર તથા નિરાશ્રીત ઘ્યતું તેમની હેખરેખ નીચે મૂક્યું અને તેની એક્સિસ જેપુરમાં રાખવામાં આવી.

૩ શેઠ લાલભાઈ દલપતભાઈને સુરતથી પાલણુપર સુધીમો પ્રદેશ તથા કાઠિયાવાડ, કર્ણ અને સીંધને લગતું કામકાજ અને કેળવણીખાતું તેમની હેખરેખ નીચે મૂક્યું તથા તેમની એક્સિસ અમદાવાદમાં રાખવામાં આવી.

૪ બાળુરાય કુમારસિંગલું મુઝીમને બાંગાળા વાખવ્યપ્રાંતો છ્યક્ષદેશ, એરીસા( નોર્થ વેસ્ટ પ્રેવિન્સીસ ) અને પંજાબને લગતું કામકાજ તથા જરૂર તિર્યોદ્વારનું આતું તેમની હેખરેખ નીચે મૂક્યું અને તેમની એક્સિસ કલકાતે રાખવામાં આવી.

જ્યારે પ્રોન-સીઅલ સેટરી તરીકે અમદાવાદમાં મી. હીરાચંદ્ર કુલભાઈ તથા મી. અગુલભાઈ કુતેહુચંદ્ર કાર્યભારી. લાવનગર શેઠ કુંવરલું આણુંદ્ર, એવતા મી. દામોદર બાપુશા. માલેગામ. મી. બાવચંદ્ર હીરાચંદ્ર. અજમેર રાયળહાદુર સોલાગમલલું દ્વા. રતલામ શેઠ ચાંદનવલું. તથા ભરુચ શેઠ અનુપચંદ્ર મહુકચંદ્ર નીમ્યા. અને જનરલ સેકેટરીએ પોતપોતાનું કામ આગળ અલાવતાં તેતે

આતામાં પૈશાનો સદગ્યોગ કરવા માટે જુદી રીતે તપાસ તથા આપલે શરૂ કરી અને કામ આગળ ચાલ્યું. તેટલામાં ફર્જાંયે સુંભદ્રના રેસીડેન્સી જનરલ સેકેટરી અને બીજી કોન્ફરન્સના ચીકું સેકેટરી શેઠ ઇક્સિચરન્સ પ્રેમચંહના ભવિષ્યથી એક મોટા ઇટકો પડ્યો. શેઠ ઇક્સિચરન્સનો ઉત્સાહ લાગણી અને વિચાર વખાણુવા લાયક હતાં. સુંભદ્રની કોન્ફરન્સની અસાધારણા ઇતોહ તેમને આભારી હતી તેમ કહેવામાં પણ કંઈ અતીશયોક્તિ નથી. વળી તેમણે પોતાના કાર્યની શરૂઆતમાંજ સુંભદ્રમાં જઈનફૂડીસ્પેન્સરી વગેરે શરૂ કરવાને ધટ્ટી તૈયારી કરી હતી, પરંતુ ફર્જાંયે આ સધળું અમલમાં મૂક્યીશકે તે પુર્વે તેમનું ભવિષ્ય ચવાથી જઈન પ્રણમાં લારી અંસોસ ફેલાયો અને છેલ્દે તેજના હુંહે શેઠ સા. વીરચંહ ભાઈ હીપચંહ સી. આધ. ઈ અને. જે. પી. ની નેમનોક કરી કાસુ શરૂ રાખવામાં આવ્યું અને આ પ્રમાણેની કાર્યની વહેંચણીથી વડોદ્રા ખાતે ભરાઓદી બીજી કોન્ફરન્સ દરમિયાન તેમણે નીચે પ્રમાણે કામ કર્યું હતું.

### બીજી અને બીજી કોન્ફરન્સ દરમિયાનનું કાર્ય.

આ વર્ષની મૂદૃત દરમિયાનમાં સુંભદ્રની કોન્ફરન્સ ઓફિસે ડિરેક્ટરીનું કામ કેવી રીતે પાર ઉત્તારવું તે માટે જુદી જુદી રીતે કાર્યારંભ કર્યો. પરંતુ તે છેવટ નીચ્ચે ઉપર આવી શક્યાનહિ. કોન્ફરન્સ ગ્રત્યે ચાહ વધારવા અને ચાર આનાની ચોજના હાથ ધરવા માટે ઉપરોક્ત મોકલવામાં આવ્યા હતા કે જેમણે કરેલા યત્નથી પચાસ ગામે સુકૃત ભાડાર નામે ચારાનાની ચોજના સ્વીકારી, પરંતુ એદની વાતછે કે તેનો અમલ ઇક્તા ત્રણ ગામો તરફથી કરવામાં આવ્યો હતો. આવી ચોજનાઓ જ્યાંસુધી મોટાં શહેરો નહિ સ્વીકારે લ્યાંસુધી. તેની ઇતોહ માટે ચોછીજ આશા રાખી શકાય તે સ્વાભાવીક છે. અને તેથી સુકૃત ભાડાર જેવા કોન્ફરન્સની મજબૂતીના મહાન ભાધારણુને મોટા આમોશે તાકીદે સ્વીકારી તેનો અમલ સર્વત્ર કરાવવા મહદુગાર થવું લેધાશે છે.

ઉપરના કોણ્ણરન્સ ઓફિસે કરેલ સામાન્ય કામકાજ સંવાદ જુદાં જુદાં ખાતાં જે સેકેટરીઓને વહેંચી દેવામાં આવ્યાં હતાં તેમના તરફથી વર્ષ દરમિયાન જુદા જુદા ખાતા માટે નીચે પ્રમાણે વ્યવસ્થા થઈ હતી. નિરાશીલ ખાતા માટે ખાસ યન્ન અને તપાસ ઉત્તર હિંદમાં કરવામાં આવતાં ફૂલ પાંચ છ હમેદવારો મળી આવ્યા હતા. ત્યારે શુજરાત કાડિયાવાડમાં તેવીશ જણુને મળી રૂ. ૨૫૬ ની મદદ આ પવામાં આવી હતી. મી. દાદુએ પુસ્તકેણ્ણાર ના કાર્યમાં સારો શ્રમ લઈ પાઠ્ય ખાંબાતના ભાંડારો માટે ટીપ કરવવાનું શરૂ કરવા ઉપરાંત જેસલમેરનો ભાંડાર ઉધડાવવામાં મદ્દા પરિશ્રમે ફોન મેળવી હતી. અને તેની ટીપ પણ શરૂ કરવામાં આવી હતી.

કેળવણુંખાતામાંથી જુદી જુદી ઓગનીશ નૈન શાળાએ માટે રૂ. ૧૧૬૫-૧-૬ આપવામાં આવ્યા હતા. અને વ્યવહારીક કેળવણીમાં આગળ વધવામાં અશક્ત હોય તેમને સરકતા અને મદદ માટે ખાંબાત વિધાર્થીઓ વર્ષચે રૂ. ૨૪૭-૧૦-૦ આપવામાં આવ્યા હતા. કે જેમાં હૃદયસ્કૂલ અને કેલેજના વિધાર્થીઓનો પણ સમાસ થાય છે. તે સિનાય હુલર ઉદ્ઘાગની કલ્યાણી માટે પણ એક વિધાર્થીને રૂકોલરશીપ આપવામાં આવી હતી.

અણુણ્ણારમાટે પ્રાચીન કલ્યાણુકલ્યુભી. શ્રીસોરીપુરાણ, શ્રી મી પિતાનગરી, શ્રી બનારસ, શ્રી રાજબહીનગરી વડગામ, કાપેડાલુ, એવાડના મંદિરો, અને શાહુજહાનપુર તથા રાદુજુલાના રંધનપુરના મંદિરાના અણુણ્ણાર માટે રૂ. ૧૮૬૦.૦૦. અર્ય કરવામાં આવ્યો હતો.

અવકદમાના પ્રચાર અંદે જુદા જુદા ચાર ઉયદેશકેને ચોતરફ ચોકલવામાં આવેલા કે જેને અંગે તેમણે કેટલીક પાંજરાપોળોના બાબતા ધોરણમાં સુધ્યારો કરવા ઉપરાંત અશક્ત પાંજરાપોળોને મદદ અપાવી ધોરણુસર થરૂ રખાવી હતી. પરંતુ પાછળથી તેવા ઉપદેશકેની ગેરહુાજરીમાં કામ અટકયું હતું,

હુલર ઉદ્ઘોજ નિર્ધભીને ઉધમ આપવાના ઉદેશભી હુલર

બિદ્યોગમાં પ્રેરવા કરેલી ચોજનામાં ચાલુ તાતકાલીક પેદાએશના ધાંધા કેપોઝિટર, ફેરોટાઇપરાઇટર, અનુક ડીપીંગ, શોટ હેન્ડરાઇટીંગ, ઘડીયાળી, ગીટ, રખરસ્ટેપ વગેરે વગેરે કામોભાં જોડવાની સર તે ઉમેદવારોની તપાસ કરી સંતોષ પકડવામાં આવ્યો હતો જ્યારે મુંખુંમાં લાલણાગ જઈન બોર્ડિંગ બિધાદવામાં કાર્યની પુર્ણાહૃતી થઈ હતી અને આ રીતે એકંદર રૂ. ૭૨૦-૬-૦ પુસ્તકેદ્વારામાં રૂ. ૪૦૭૦-૬-૦ મંદિરદ્વારામાં ૧૦૮૧-૬-૦ નિરાશ્રીત ખાતે રૂ. ૨૩૮૪-૧૧-૬ જીવદ્યા ખાતે રૂ. ૪૬૧૦-૧૫-૦ કેળવણીમાં અને રૂ. ૩૨૭૩-૧-૭ કોન્ફરન્સ નીલાવદ્વારામાંથી ખર્ચ કરવામાં આવ્યો અને આરીતે કોન્ફરન્સ ઓફિસ પાસેના ઇંડમાંથી વ્યાજની આવક જમા કરવા પછી ખર્ચ જતાં રૂ. ૮૮૬૫-૧૦-૬ નાડી પ્રાંત રદ્દા હતા.

### તીજુ કોન્ફરન્સનીતેયારી અને કામકાજ.

આપણે ઉપર જોઈ ગયા તેમ તીજુ કોન્ફરન્સ વડોદ્રા ખાતે ભરવવાનું બીજું અદ્યથું હતું તે વડોદ્રાએ પોતાના ગામ ઊપરાંત છાણી, પાદ્રા દરાપુરા વગેરે સ્થળના શ્રી શાંધને પેટામા લધ શરૂ કર્યું હતું: અને તેમાં તેમણે મુંખું ઊપરાંત જૈન સાહિત્યનું લાક્ષણીક પ્રદર્શન ભરવાના કાર્યનો ઉમેરો કરવા ને ઠરાવ કરી તેમાં ફ્રેન્ડ મેળ વી હતી. કોન્ફરન્સના કાર્યમાં સરલતા દર્શાવવા માટે અને દરેક રીતે તેને ફ્રેન્ડમંડ ઉતારવામાં આપણા સુનિગણુની હાજરી શરૂઆતથી જ બહુ ઉપયોગી થક પડી છે. તેમ સર્વકેાએ કણુલ કરશો. કેમકે મુંખું આતે આવી ફ્રેન્ડ સુનિમહારાજ મોહનલાલજી મહારાજને આભારી છે ત્યારે વડોદ્રા આતે શરૂઆતથી ખીરાજતા આચાર્ય સુનિમહારાજ શ્રી કુમલવિન્દ્યસુરીની હાજરી કિમતી થઈ પડી હતી.

વડોદ્રાની કોન્ફરન્સની ફ્રેન્ડમાં એક ધીને અધુભૂતી, લાલ એ હતો કે વડોદ્રાના નામદાર મહારાજ શ્રીમંત સરકાર ગાયકવાડ તરફથી આપણુંને દરેક પ્રકારની મદદ અને કોન્ફરન્સ મસંગે હાજરી





દાયખાહુર બુદ્ધસિંહજી દુધેડીઆ—મુરસીદાખાદ.  
પ્રમુખ-શ્રી ગોળ લૈન ચેતામાર કોન્કરન્સ  
(૧૯૪૨૧૦)

૧૯૪૮ સં ૧૯૪૭.

આપવાનું જહેર, કર્યું હતું તથા પ્રમુખ સ્થાન શ્રી અજુમગાંજ  
( મુર્શિદભાઈ નિવાસી રાય બહાદુર ઘુણ્ણિસિગળુ કુદ્ધેડીયાએ  
સ્વીકાર્યુહતું). જ્યારે કોન્ફરન્સનો દિવસ સં. ૧૯૬૧ના કાર્ટિક વર્ષી ૫  
તા. ૨૭ નવેંબર સન. ૧૯૦૪ રવિવારથી ત્રણુ દિવસ દરવાજાં  
આવા હતા. અને લાક્ષણ્ણીક પ્રદર્શન તા. ૨૪ મી નવે-  
બરે શ્રીમંતુ યુવરાજ ઇતેહસીહરાવ મહારાજના હુસ્તક ખુલુસુકવામાં  
આંધું હતું. ભદ્રરહુ પ્રદર્શનમાં જ્ઞાનની પ્રાપ્તિ, દર્શનની શુદ્ધિ,  
અને દેવગુરુની પૂજા તથા ચિત્રિની નિર્મણતા માટેના અગત્યનાં  
નિષ્ય નૈમિત્તિક છિયામા જે જે જાહીલ્ય વરસાય છે તે તમામ ઉપ-  
યોગ અને હેતુ સાથે બતાવવામાં આવા હતાં. અને તેમાં મહુ-  
વીઠુનો દેખાવ, ઘોણીડાની સજાયનો ભાગાર્થ, વખુઆરાના સ્વાધ્યાયનું  
ચિત્ર, છવેશ્યાનું ને અનેકાંતમતની સિદ્ધિ દર્શાવનારૂં પાંચ આંખળા  
અને હાથીનું તેમજ ચાર સંજીવની ન્યાયનું ચિત્ર સમજવવાના  
દેખાવ ખાસ લક્ષ ખેંચી શકયા હતા.

કોન્ફરન્સના અર્થ તરફ દાખિ દેરવીશું તો શરૂઆતમાં આવ-  
કાર દેનારી કમિટીના પ્રમુખ રા. રા. ઇતેહભાઈ અમીચંદ ભવેદીએ  
સત્કાર આપનાં કોન્ફરન્સનો હેતુ તથા તે દરવાજાની આવ-  
સ્યકૃતા સમજવી તેમાં થતા હરાવો અમદવામાં મૂકવા એતાઓનું  
દશ એચ્યું હતું. ત્યારબાદ વડોદ્રાના નામદાર ગાયકવાડ સરકાર  
એ સંયાળરાવ સેનાખાસ ખેત સમશેર બહાદુરે જણાંધું કે  
“તમારા જઈન વર્ગ પૈકીનો ધણો ભાગ વેપારી છે, અને પરચેખરે  
તમને જે કાઢ સંપત્તિ આપી હોય તેનો સદૃષ્યોગ કરી સંસારમાં  
પોતાની અને જરૂરની સારી રીતે ઉત્ત્રતિ થાય તેમ હરવું લેખું  
તર્યો આ સમ્પર્ણમાં દરેક વિષય ઉપર થાંતતા અને સારી સમજ  
થી હરાવ કર્યો. અને તે હરાવો સંસાર વ્યવહારમાં અમદવામાં પણ  
થાંબણો.” આ પ્રમાણે તેનો શ્રીએ ક્રિમતી સુચના હરા બાડ  
પ્રમુખે પોતાના વિચારો જણાયા હતા.

## રાય ખણાકુર બુદ્ધિસિંગજી દુધેડીયા.

પ્રશુભ રાય બુદ્ધિસિંગજી દુધેડીયા અંજુમગંજ (મુશોંદાખાઈ) ના વત્નિ અને મોટા જહંગિરદારછે. તેમની જન્મ તિથિ અને ઉદાર ધતિહાસ કહેવા કરતાં તેના વિચારો તેમના સદગુણુનું ઉચ્ચ સ્વરૂપ ખતાવી અપેછે. અને તેથી તે તરફ દષ્ટિ કરીશું તો આપણુને ઘણું જાણવાનું મળી આવશે. ફરીને કરો તે તેમનું પ્રથમ સિદ્ધાંત હતું અને તેથી તેમણે જાણવેલું કે, “આપણે જે કાગ શરૂ ક રેલ છે તે એક વખતે સંપૂર્ણ ન થાય તો નિરાશ થઈ એશી ન રહેતાં ફરી પ્રયત્ન કરો, ત્રીજી વખત કરો અને તે રીતે જ્યાં સુધ્ધા તે જીચ કામ પૂર્ણ ન કરી શકીએ લાંસુધી તે માટે પ્રયત્ન શરૂઆપીથું તો તે સંપૂર્ણ ઇતેહમંદ જેવાશે. લાંબા વખતથી આપ એમાં સ્વાર્થ સાધવાની ખૂરી ટેવ પડી ગઈ છે તે ધીમે ધીમે ફરીને શાંધનું હિત કેવી રીતે થાય તે વિચાર કરવો જોઈએ.

દરેક રસ્તા સારું નથી, દરેક કુલ કાંટા વિનાનાં હોતાં નથી, જેમ આપણા રસ્તામાં કોથ, માન, માયા, લોભ, ઈર્ષા, દ્રેષ, કલહ, મી અયાલિમાન, કુષંપ વગેરે પ્રકૃતિવાળા લૂટારા બહુજ મળશે. કે જે નાથી બચીને ચાલવું અને તેને સન માર્ગે લઇ જવા તે ખરા જધનું મુખ્ય કર્તાબ્ય છે અને તે કામ સંપ અને ઐક્યતાથીજ ખની શકે છે. આ ફુનિયાં પણ પરસ્પરની રહ્યાયતાથી ચાલે છે, એ પ્રમાણે આ સમાજ એક પુરૂપ છે અને ભરતખંડમાં વસ્તા દરેક જૈન તેનાં અંગોપાંગ છે અને તેથા સૈચે પોતાનું કામ બજાવી તેને પુષ્ટ કરવાનું છે. અને તે રીતે કોન્કરનસની તમામ ઇતેહ સંપ ઉપર આ ધાર રાખે છે, મોટાઓએ મોટી ખીરજ રાખવી રાખવી જોઈએ તે પ્રમાણે કોન્કરનસમાં માન એછું કે વધારે ભગે, પોતાની મરજીના સ્વાસ પાસ થાય કે ન થાય, તે માટે ખીલકુલ નાખુશ થવું નહિ. મોટા નાના કે ધનવાન ગરીબનો કરો લેદ રાખવો નહિ, પરંતુ ઉલ્લાસ ધનવાને ધનથી, વિદ્ધાનને વિદ્ધાથી અને શક્તિવાને શક્તિકિશ્ચ

મથી કોન્ફરન્સના કામમાં મદદગાર થવું : ”આ ઉપરાંત તેમની સૂચના વિવહારિકાની સાયેજ ખામીંક શિક્ષણ હેવા માટે તથા એંશિ ક્ષણની જરૂરીઆત અને વાંચનમાળા તૈયાર કરવાની સૂચના વગેરે વિચારો તરફ દાખિ ફેરવતાં તેમના જીવનમાં ખુપાએવા સંદગ્યના જીંશા અભ્યાસ પણ રીખવાના મળી આવેછે,

### ઠરાવોનું સ્વરૂપ.

વડોદ્રા કોન્ફરન્સમાં પસાર થાયેલા ઠરાવોમાં કેટલાક મુંબઈના ઠરાવોને અનુસરતા હૃતા. લારે જેકે તેમાં અનુકૂળ સુખારો વધારો કરવામાં આંદો હતો. તોપણું તે દરવર્ષ વધારે આખાદ રૂપમાં મૂકૃતાં છેવટ ભાવનગરની કોન્ફરન્સમાં પસારે કરાવવા માટે જે ખરડો તૈયાર થયોછે તે અમારા વાંચનાર માટે રણું કરેલ ડોલાથી રેવા ઠશવને ફરી ફરી પ્રગટ કરી વાંચનારને કંટાળો આપવાને ફુરસ્ત ન ખારતાં તેમાં જે નવા વિચારો સુકાયા હોય તે તરફ લક્ષ એંચીશું તો તેમાં સૈંથી વધારે આનંદ ચુક્તા ઠરાવ આગલા વર્ષમાં કોન્ફરન્સના ઠરાયો અમલમાં મૂકુવવાના કામમાં મુનિ મહારાજેએ જે પ્રસંગ પાત્ર પ્રયાસ કર્યો તેનો ઉપકાર માનવાનો હતો.

આ ઉપરાંત કોન્ફરન્સ ઓછા ખરેં ભરાય શકે તેમ સંગપડ કરવા તે પછીથી ડેલીગેટોની રૂ. એ ફ્રી રાખવામાં આવી હતી. અને કેન સમુદ્દરમાં સંપની વૃદ્ધિ થાય તેવા ધતન કરવા વિચારવામાં આંદું હતું. તથા પ્રાચિન શોખ ખોળ કરવાની જરૂરીઆનનો નર્વા કરાવ સ્વીકાર્યો હતો.

### સખાવત

આપણે મુંબઈ માટે જોઈ ગયા તેમ વડોદ્રા પણ મુંબઈ જેટલે આંશો નફી પરંતુ સારી રીતે કુંડને વધારવા શક્તિવાન થયું હતું, કે જેમાં મુખ્ય કેટ પ્રમુખ તરફથી રૂ. ૫૦૦૦ ની જહેર કરવામાં આવી હતી ત્યારે નામદાર જાયકવાડ સરકારે રૂ. ૫૫૫૫૦ નાંના મણી પરચુરણ મળી તેનો સર્વાળો હશ્વાળર હોયાં. થયે હુલો

## ગ્રંજ્યુએટ એસોશીએસન.

આ ઉપરાંત મી.દ્વાના પ્રમુખપણું નીચે જૈન ગ્રંજ્યુએટ એસોશીએસન સ્થાપી તેમાં નીચે પ્રમાણે ઠરાવ કર્યા હતા.

૧ દ્વાના સધળા શ્વેતાંખર જઈન ગ્રંજ્યુએટોનું એક મંદળ કેંન દ્વરસના સંબંધમાં ઉભું કરીતેનું નામ “ જઈન શ્વેતાંખર ગ્રંજ્યુએટ્સ એસોશીએશન ” રાખવામાં આવેછે, તેના પ્રમુખ તેરીકે મિશ્રલાભચંદળ દ્વાના એ. ઓ.મ. ઉપપ્રમુખ ડા. ધાર્માભાઈ મગનલાલ એલ. એમ. એન્ડ એસ. અને સેક્ટરી મિ. મોતીચંદ ગીરધરલાલ કાપડીયા બી. એ. એલ. બી. ને નીમવામાં આવ્યા છે.

૨ કેંનદ્વરસના હેતુએ પાર પાડવા માટે દરેક પ્રયત્ન કરવો.

૩ કેંનદ્વરસ તરફથી મિ. દ્વાના તંત્રીપણું નીચે નીકળનાર મેળજીન ( નાસીક ) માં દરેક ધાર્મિક તેમજ સામાજિક વિષયો લખવા.

૪ પાંચ વર્ષ તથા તે ઉપરની મુદ્દતના ગ્રંજ્યુએટોએ કેંનદ્વરસના નિલાવ માટે વાર્ષિક લવાજમ ડા. ૪ આપવું.

૫ પાંચ વર્ષની મુદ્દતની અદરના ગ્રંજ્યુએટોએ વાર્ષિક લવાજમ ડા. ૨ આપવું.

૬ એસોશીએશનના દરેક સભાસદને કેંનદ્વરસ તરફનું માસિક વગર લવાજમે મોકલવા કેંનદ્વરસનાજ સેક્ટરીને વિનંતી કરવી.

૭ આ ગ્રંજ્યુએટ માટ્યમાં બારીસ્ટરો, હાઇકોર્ટ્સ્ટીલરો અને ડીસ્ક્રિપ્ટ પ્લીડરોને પણ દાખલ કરવા.

કેંનદ્વરસ પછી થએલાં ભાષણોમાં મુનિમહારાજ શ્રી આચાર્ય કુમળ વિજયજી સુરીમહારાજ તથા મુનિશ્રી વિનય વિજયજીએ કરેલો ઉપરેશ બહુ અસરકારક થવા ઉપરાંત લવિષયને માટે ઘડો આપનાર થઈ પડ્યો હતો. વળી પુનાના કેસરી પત્રના અધિપતી ભી. ખાળગાંગાધર ખલકે જઈન ધર્મની મહૃતા માદે રણ્ણ કરેલો વિચારો તથા મી વીરચંદ રાધવજી પેઠે પરદેશ ગમન કરી જઈન ધર્મનો ઉપરેશ આપનાર ખીલ તેચાર થાના તેન સૂચના કરી અહીંસના પ્રસાર માટે મૂળય માન જઈન ધર્મને આપ્યું હતું.

અને બાતના નાગર છતાં વિચારમાં જઈન, જુનાગઢવાળા મીઠાભણ્યાં કરે અને લક્ષ્મિથણ્યાં કરે અને કાંઈ પોરણે અમ હેતું તે સમ્ભાવતાં હુલમાં થતી ધર્મને નામે, ખોરાક માટે, શિકારના શોખની તૃપ્તિ અથે, દેશન સારુ અને સાયન્સ નિમિતે જીવહિસાના બેવાતા બેઠ સમજાવી અટકાવવાના ઉપાયો સુચચ્ચા હતા.

શ્રીમંત ચુવરાજ ઇતેહસિંગરાચે ખાસ સૂચના કરી કે “ દરેક કોન્ફરન્સે કંઈ કંઈ મુશ્કેલી હુર કર્યાની અને ભવિષ્યના સુધારા વધારાના રસ્તા કર્યાની ચોતાને દરૂતરે નેંઘ લીધાનું પણ જોઈ શકીશું.”

છેદે કોન્ફરન્સના જનરલ સેકેટરીએ તરફનો અનુભવ શોઠ લાલલાઇ દલપતલાઇએ રજુ કરતાં ચાલતા બંધારણુંમાં સુધારા વધારાની ભવિષ્ય માટે જરૂર સ્ત્રીકારી. કંમ નવું અને ધણું હેવા સણબ દરેક જઈનલાઇએને બનતી મદદ કરવા લલામણું કરી. સુકૃત બંડારની ચોજના અમલમાં લાવવાના લાભ સમજાવ્યા હતા. કોન્ફરન્સના મોટા ખર્ચ માટે એલતાં જચાંયું કે કોન્ફરન્સને આપણે કાયમી કરવી છે. તો પરોણુને જેમ ઐચાર દિવસ માટે રોકવા મીઠા બોજન પીરસાયછે તેમ ન કરતાં તેને ધરના માણુસ પેઠે નિયમના ખોરાકથી કાયમી કરવી જોઈએ. વળી કોન્ફરન્સને પૈસાની મદદ માગણે પરંતુ જે સંપ નહિ હોયતો આપણે કોન્ફરન્સને નિભાવી શકવાના નથી. કારણ પૈસાની મદદ ‘કરતાં પણ વધુ જરૂર સંપની છે. તે ખાતર આપણે દરેકે ઝાંઝીઝીએ ખાણતોનો મત બેઠ હૂર છી એકજ મુદ્દા ઉપર આવવું જોઈએ. તેલીગેટો બેહુલર બેગા થધ હુકીકત સાંભળી જાયછે તેની અભર કમતીમાં કમતી પાંચહુલર માણુસો ઉપર થયા વગર રહેતી નથી એ અસર કાંઈ નાની સુની નથી. તેલીગેટાના પ્રમાણું હુદ્ધી હું વિરુદ્ધથું. હું ધર્મથું કે હું એવું કોન્ફરન્સ જોવા ભાગ્યશાળી થાડું કે તેમાં કમીમાં કમી હશે હજર જઈનલાઇએ બેગા થયા હોય. પણ તે સાથે આવું ખર્ચ કમી થાય તે હું ધર્મથું. કે જેથી કોન્ફરન્સ આપણુને ખોળ ૩૫ અંજ ન પડે.

કેટલાક સારા શહુસ્થી એવો અલિપ્રાય ધરાવેછે કે ગમે તેટલી માથાગીક કરોછો. પણ થાયછે શું ? માટે અમે તો એ પસંદ કરતા નથી. તેવા મહેરખાનોને મારો જવાબ એ છે કે તેટલા માટે પ્રયત્ન ખંધ કરવો તે આપણું જિચીત નથી તમારા ધરનો માણુસ તમારા વિચારથી ફેર વર્તેછે તો તેને શું તમે છોડી ઘાંઠો ? ના, લારે આ પણ્ણા ભીજા ભાઇઓ પ્રત્યે પણ તેમ વર્ષો.

### વડોદ્રા અને પાટણ વચ્ચે.

વડોદ્રા ખાતે ઉપર પ્રમાણે કાર્ય થવા પછી તથા ઉત્સાહમાં આગળ વધવા પછી લ્યાંની ફુટેહુથી ખુશી થધ પાટણુખાતે કોન્કરનસ લાવવાને લ્યાંના વત્તિની શોઠ પુનમચંદ કરમચંદે માગણી કરો અને તે મંજુર થવાથી ચાંચો મેળાવડો પાટણ લાવવાને હર્યો અને તેથી મુહૂત દરમિયાન જાગૃત્તિ જાળવી રાખવાનું કામ કેંન્કરનસની કાયમી ઓફિસ તથા ચાર જનરલ સેકેટરી ઉપર આવી રહ્યું. જેથી ચારે જનરલ સેકેટરીને પોતપોતાના કામને માટે પ્રથમ કરેલ ગોઠવણુમાં ફારફૈર કરી દરેકને પોતપોતાના પ્રાંત માટે દરેક ખાતાની ફેખરેખ રાખવા હરાંયું. અને પ્રેવીન્શીયલ સેકેટરીમાં વધારો કરી માળવા, રંગુન, સોલાપુર, એંગલોર, નીઆમહૈદ્રાળાદ, પુના, સુરત, બાલાપુર, અને લાહોર માટે અમુક નવી નેમનોક કરી. દરેક જુદા જુદા પ્રાંત માટે અનુકૂળ જણુતું ખર્ચ કરવામાં આંયું હતું. કે જે થંવા પછી વર્ષ આખરે દરેક ખાતામાંથી ખર્ચ જતાં. રૂ. એકલાખ જેટલી રકમ બાકી પ્રાંત વધી હતી.

વર્ષ દરમિયાન આરીતે ચાલુ કાર્બ થવા ઉપરાંત મુંબઈખાતે નવી એડ્ઝિંગ સ્થાપવા માટે રૂ.૭૫૦૦૦ પંચાતેરહુલર શોઠ ગોકળ બાંધ મૂળાચંદે અને રૂ. ૨૫૦૦૦ પચીશહુલર કોન્કરનસે આપવા નક્કી થયું હતું. પરંતુ જયારે તે કણુલાતનો અમલ અધારી થણેલો એક શક્તિની નથી લ્યારે આનંદ કરતાં એદ બેલડો વધી જયાંછે. કોણ્ણ શોઠ ગોકળબાંધ શુજરી જવા માટે એહ દર્શાવવા પછી આશા



રાય બાહુર સીતાભયંદ નાહર.  
પાંચમી શ્વેતાગ્નિમર કો-ઇર-સના પ્રેસીટ-એ.  
આમદાદ.



રહેણે કે તેમના પુત્રરત્ન તે કાર્ય હૂાર પાડશે કેમકે હાલમાં રાખું  
લામાં આવેલ મનુનની અપૂર્ણતા કાર્યને અધ્યવષ્ટ્યે લટકાવે છે.

### પ્રાંતિક કોન્ફરન્સ.

આ ઉપરાંત બધું અગાથનું કાર્ય વર્ષ દરમિયાન પ્રાંતિક કોન્ફરન્સના મેળાવડા થવા સંખ્યેનું થયું હતું. આવા મેળાવડામાં એક દક્ષિણમાં અમદાવાદ ખાતે અને બીજે, ઉત્તર ગુજરાત માટે પેથાપુરમાં થયા હતા. અને તેમાં પેથાપુરના મેળાવડા પ્રસંગે અમદાવાદમાં જઈન ઓર્ડિંગ જોવવા ઇંડ થયું હતું કે જે બીજના શુભ કૃગરૂપે શેડ લિલુઅર્ડ રાયજી જઈન ઓર્ડિંગ મજબૂત પાયાડિપર એક લાખની માત્રા સખાવતથી સ્થાપીત થવા પામી છે.

### પાટણું કોન્ફરન્સ.

આપણે અગાઉ જોઈ ગયા કે પાટણું ખાતે કોન્ફરન્સ લઈ જાનું બીડું લાંના વત્તિ ખાનદાં કુંદુંબના નખીરા શેડ પુનમચંદ કરમચંદ જડચ્યું હતું. અને તેથી તેને ફેલુંમંડ રીતે પાર ઉત્તરાને તેમણે માનેનો! અને તન મન તથા ધનના મોડા બોગે રાત્રી દ્વિવસ શ્રમ ચર્ચ રાખ્યો હતો. તથા શ્રીસંઘે મળી આવકાર દેનારી કમિટિના પ્રમુખ તરીકે તેઓ શ્રીનેપસંદ કર્યા હતા. જ્યારે નગરશેડ હેમચંદ વસ્તાચંદને જનરસ સેકેટરી અને રતનચંદ વસ્તાચંદને ચીક સેકેટરી નેમનામાં આવ્યા હતા. તથા કોન્ફરન્સના પ્રમુખ તરીકે શેડ વીરચંદભાઈ દીપચંદ સી. આધું ઈ. અને જે. પી. ને સ્વીકારવું વિનંતી કરી નકી કર્યું.

### શેડ વીરચંદભાઈ દીપચંદ

શેડ વીરચંદભાઈ જાતે વીશાશ્રીમાળી અમદાવાદ તાંબે સાંચુંડ તાલુકાના ગોધાવીગામના વત્તિ છે. તેમનો: જ-મ સન. ૧૮૮૬માં અનેલો તેમણે બચપણું ખામીક અભ્યાસ કરવા પછી સતર વર્ષની ઉમરે ગુજરાતી તથા અંગેલ અભ્યાસની અમદાવાદમાં જઈ શરૂઆત કરી. તેમના બાળલિઙ્ગનમાંથી શીખવાનું છે કે તેની

મુજાસ્થિતિ નરમ છતાં હિમત અને દફતાથી સંવત. ૧૮૫૭માં રા. ૨૪માં નોકર રહી તે પછી યુદ્ધિણો અને અમદાવાદના શેડની પ્રીતિથી વેપારમાં આગળ વધ્યા અને તે રીતે હીર્ઘદર્શીપણુથી અત્યારે લક્ષ્ણાધીપતી થવા લાગ્યશાળી થયા છે કે જે પેદાચેશ મુખ્યત્વે શેર અને મીલના વેપારને આભારી છે.

આ પ્રમાણે તેઓ આગળ વધવા પામ્યા તે સાથે તેમની ઉદ્ઘારતા વખાણુવા લાયક છે. શા. વીરચંદ રાઘવજીને અમેરીકા મોકલવામાં અને કેળવણીના કામમાં સારી સખાવત કરી છે. તેમના વિચારે તેમના સદગુણુની અખી છાપ રખું કરે છે. તેમનું ભાષણ ઘણું મહુલ્લતાવાળું હતું અને દરેક વિષય ઉપર ણહું સારા વિચારે રખું રહ્યો હતા. છેવટ પંચાયતથી કળુઆ પતાવવાના ઘોરણુની શરૂઆત કરવા ભલામણું કરી જણાયું કે અગાઉના વખતની આપણી શક્તિ. આપણું ગૈરવ, આપણી જાહેરલાકી એક્ય અને ધર્મની શૈષ્ટતા વિશેખયાલ કરે. આપણો ધર્મ તેનો તેજ છે, સિદ્ધાંતો તેનાં તેજ છે, ઇક્તા આપણે આપણું કર્તાબ્ય બુદ્ધયા છીએ. અને તેનું આ પરિણામ છે. પરંતુ હવે જયારે તે પરિણામના કારણો અને ઉપાયો આપણુને સ્થૂચવવામાં આવ્યા છે. માટે અધારે એકજ દફતા અને નિયમથી પ્રયાસ કરીને પુરુષર્થ કરવો.”

ચોથી કોન્ફરન્સમાં થએકા ઠરાવો તરફ દષ્ટિ કરી શું લારે આંદર અંદરના કળુયા પતાવવા માટે લવાદથી કામ લેવા, જઈન કરું વિધિ શરૂ કરવા, અને ચુનિવરસીટીમાં જઈન સાહિલ્ય હાખું કરવાના ઠરાવ નવા હતા.

આ કોન્ફરન્સ વખતે મુનિગણુમાં મહારાજ શ્રી પ્રવર્તક કાંતિ વિજયજી. તથા તેમના શિષ્ય ચતુરવિજયજી, મહારાજ વગેરે હતાં

### જાના લોનિધિ પ્રદર્શન

વડોદ્રામાં લાક્ષ્ણીક પ્રદર્શન ભરવામાં આવેલું લારે અતે જાનાં લોનિધિ પ્રદર્શન ભરવામાં આવેલ હતું; એનું તેમાં પ્રાચિન અંથો કાગળની માખમલની ચેટીએ, સાખુ, મીઠુખતી, કોતર કામના ના

ઝુના, શાંકો અને કાપડના નમુના હતા, સદરહુ પ્રદર્શન વડોદ્રાનાં  
અમાત્ય રેમેશચંદ્ર હતે જુદું મૂકુદું હતું

### પહેલી મહિલા પરિષદ.

પાઠણે પોતાના કાર્યમાં નવો વધારો કર્યો તે મહિલા પરિષદની  
શરૂઆત કરવાનો હતો, કે જેનું પ્રમુખ સ્થાન મી. દ્વાનાં માતુશ્રીને  
આપવામાં આવેલ અને સ્વીગ્રાચે ખારસોની મોટી સંખ્યામાં હજરી  
આપી હતી, જેમાં સ્વી વક્તાઓએ લાખણો આપવા પણી નીચેના  
ઠરાવો પસાર થયા હતા.

૧ જઈન બાનુઓએ ધાર્મિક, વ્યવહારિક તથા હૃત્તર કળાની કે  
ળવણી દેવી.

૨ જઈન જાતોમાં સંસારિક હુાનીકારક રીવાજે ચાલેછે, તે  
કુર કરવા.

૩ જઈન કેંનફરંસે જઈન ખાનુઓની ઉજતિ માટે જે ઠરાવો  
કર્યા તે માટે આલાર માનવામાં આવેછે.

૪ જઈન બાનુઓની આજે મળેલી આ સમા આ સંમારલનું  
નામ પહેલી જઈન મહિલા પરિષદ રાખેછે.

૫ બીજી જઈન મહિલા પરિષદની બેઠક અમદાવાદ ખાતે પાં  
ચમી જઈન કેંનફરંસ ભરાયતે પ્રસ્તુતે ભરવાનો ઠરાવકરવામાં આવેછે

૬ આ ઠરાવો કેંનફરંસ ઉપર મોકદી આપી તેઓ જે પ્રયાસ  
કરેછે. તેમાં થથા શક્તિ મદદ આપની.

છેદે પાંચમી કેન્નફરન્સ અમદાવાદ અને છુટી ભાવનગર ભરવા  
ઠરાવ કરી તથા વ્યવસ્થા માટે વધુ આસિસ્ટન્ટ જનરલ સેકેટરીની  
નેમનોક કરી મેળાવડો વીસર્જન થયો હતો. જ્યારે પાઠણુખાતે  
દરેક ખાતામાં મળી રહી હતી. ૧૩૬૪૩-૫-૨નું ફેફંડ થવા પાણ્યું હતું.

પાઠણું પછી અમદાવાદ સર્વે મળે તે દરમિયાન મારવાડમાં  
ક્લોધીખાતે રજુપુતાના પ્રાંતિક કેન્નફરન્સ ભરવામાં આવી હતી.  
લારે સુકૃત ભંડાર થાર્ડ ન થવાની ફરીઆદ ઘણું રહેવા માટી હતી.

અને હિસાબ તપાસવા માટે એક માણુસ મોકલી શરૂઆત કરવામાં આવી હતી.

કેન્ફરન્સ ઓફિસના હુસ્ટકનાં દરેક ઇંડોમાંથી જનરલ સેકેટરીએચે જરૂર જોગું અર્થ કર્યું હતું જે જતાં વર્ષ આખરે નીચે પ્રમાણે દરેકમાં પ્રાંત રહી હતી. કેન્ફરન્સ નીલાવ ઇંડ ડા. ૮૮૬૫ જીણ પુસ્ટકેદ્વાર ખાતે ડા. ૧૭૨૭ જીણમંહિરેદ્વાર ખાતે ડા. ૬૨૬૩ શ્રી નિરાશ્રીત ઇંડખાતે ડા. ૧૫૮૬૭ શ્રીજીવ હયા ખાતે ડા. ૧૧૪૦૧ શ્રી કેળવણીખાતામાં ડા. ૪૬૧૬ શ્રી ધાર્મિક હિસાબ તપઃસણી ખાતે ડા. ૨૧૩ શ્રી સુકૃત લંડારખાતે ડા. ૧૪૬૩.

### પાંચમી કેન્ફરન્સ અમદાવાદમાં

ગુજરાતની પ્રાચિન રાજધાની પાઠ્યમાંથી કેન્ફરન્સે નવી રાજધાની અમદાવાદમાં ગમન કર્યું અને તેથી પ્રથમ આવકાર હેનારી ક્રમિના પ્રમુખ તરીકે નગરશોઠ ચીમનલાઈ લાલલાઈને નીમી કાર્ય આગળ વધારતાં પાંચમી કેન્ફરન્સ માટે તા. ૧૬ મી ફેબ્રુઆરી સન. ૧૯૦૭, ૧૯૬૩ના દાગણું શુદ્ધી. છદ્વિસ નક્કી કરી પ્રમુખ તરીકે રાયખાડુર બાળું સિતાપચંદજીનહારને પસંદ કરવામાં આવ્યા.

### રાય બાહુદુર સિતાપચંદજીનહાર.

તેચો જાતે ઓશવાળ અને સુળ ક્ષત્રિય વંશનાછે. કે જે વંશને સ્થાપનાર મુંળ પરમાર હતા. અને લારથીજ ઉત્તરોત્તર દરેક વંશને ધર્મકાર્ય તથા સખાવતમાં સુનાથીજ આગામ પડતો ભાલ લેતા આવ્યા છે. બાળું સિતાપચંદજીને જન્મ સન. ૧૮૪૭માં થયો અને તેમના માતુશ્રી કેળવાચેલ હોવાથી બચપણુથીજ તેણે પોતાના પુત્રને વિદ્યા દ્વીપિના આશ્રીત કર્યા. અને તેથી ઉર્ડુ હિંદી અને બાંગાળી ભાષાનો અભ્યાસ કરી વેપાર બ્યવહારમાં નેડાયા. શરૂઆતથી તેમનું હીલ બુઝુ ઉદ્ઘાર હતું અને તેથી પોતાનું જલદી ન પતી શકે તેવું લેણું માફુ કરવા ઉપરાંત. ૧૮૭૩-૭૪ના બાંગાળાના ફુઝાળ વખતે સારી

મહે કરી હતી કે જે ઉદ્ઘારતાથી ખુશીથિય નામદાર સરકારે તેમને રાય બહાદુરનો માનવંતો ખીતાબ આપ્યો, તેમની ઉદ્ઘારતાના નમુના તરીકે આ ઉપરાંત ધર્મશાળાઓ, જરૂર મદિરા, અનથડો. વગેરે અનેક હસ્તી ધરાવેછે, આ સધાળા કરતાં વધારે સંતોષનું કારણું છે કે તેમને ચારપુત્રો વગેરે ચાંનાંની તેને ગર્લ શ્રીમંત છનાં કેળ વણીમાં બંડુ આગાળા વધાર્યાછે કે જે ધોરણ ખાસ વડો લેવા જોગાછે.

અમદાવાદ કેંન્નરસમાં ડેલીગેટ, ૨૬૪૨ વીજીટર ૮૭૬ સ્થી વીજીટર ૧૪૬૬ આવેલાં લારે કુલ ટિકિટો ૬૪૭૭ આપવામાં આની હતી. અને કુંડમાંથી ખર્ચ જતાં વધારાની ૨૫૮ જાઈન એડીંગમાં આપી દેવાને નકી કરવામાં આવ્યું હતું.

કેંન્નરસના કાર્યની શરૂઆતમાં આવકાર હેનારી કબિનિના પ્રમુખનું ભાષણું અમદાવાદનો ઈતિહાસ રણુ કરવા સાથે કેંન્નરસથી થચેલ લાલ માટે સારો અનુભવ રણુ કરતું હતું જ્યારે પ્રમુખ સીતાપચંદળનહારના લાષણુમાં પણ તેમણે ઘણી સુચના કરી હતી કે જેમાં ધાર્નિક વાચનમાળાની જરૂર, સેંક્રિન જાઈન કોલેજની આવશ્યકતા, શિદ્ધ શિક્ષણું જરૂરીઆત, શ્રીસંઘબેંક સ્થાપવા જાઈનદો દાખલ કરવા જાઈન પર્સોમાં છુટીની જરૂર, વગેરે નવા અગ્યના નિપયો અને તેની શરૂઆત થવાની આવશ્યકતા માટે હદ્દીલસર લક્ષ ખેંચ્યું હતું. જ્યારે પણ દિવસમાં પસાર થચેલા ડરાવોમાં અગાઉની કેંન્નરસનું અનુકરણ હતું.

### મહિલા પરિષદમાં સખાવત.

અમદાવાદે પ્રદર્શન લરવા જરૂર વિચારી નહતી લારે ખીજ મહિલા પરિષદ શેડાણી શ્રાંગાર ખાઈ તે શેડ જેસી ગલાઈ હડીસિંગ ના પલિના પ્રમુખ પણ્ણા નીચે ભરવામાં આવી હતી. જેમાં બેન અનુસુયા સારાભાઈ મગનભાઈએ સેકેટરી તરીકે ઉમદા સેવા બજવી હતી. પરિષદમાં થચેલા ભાષણું અસર એટદી તો સચ્ચાઈ થવા પામી કે લાં મહિલા પરિષદમાં કુંડ ઉધાડીનો રૂ. પાંચ હજાર તેમાં ભરાયા હતા જ્યારે નીચે પ્રમાણે ઠરાવો પસાર કરવામાં આવ્યા હતા

**ઠરાવ-પહેલો-કેળવણી**—સ્ત્રી જાતિની સંપુર્ણ ઉજ્જ્વલિ અર્થે આપણી બાળાંચાને ધાર્મિક, નૈતિક, માનસિક, અને શારીરિક કેળવણી ઉત્તમ પ્રકારની મળે તથા મોટી વયની નીચોને ચોંગ્ય ઔધોગિક અને ધાર્મિક શિક્ષણ અપાય તેવી સંસ્થાઓ સ્થાપવાની આ મહિલા પરિષદ આશ્યકૃતા સ્વીકારે છે.

**ઠરાવ બીજો-સ્ત્રીનાં કર્તવ્ય**—પતિ, વડીલો, બાળકો, સ્ત્રોહી સંખધીઓ, અને દાસજન પ્રતિ પોતાનાં કર્તવ્યો કરું જે સ્ત્રી સમજતી થાય એવા પ્રકારનો ઉત્તમભોધ અપાય તેવી ગોઠવણું કરવાનાં આવનશ્યકૃતા આ પરિષદ સ્વીકારે છે.

**ઠરાવ ત્રીજો હાનીકારક દીવાજ**—ખાળવાન, રડલું ઝૂટલું વગેરે હાનીકારક રીવાજેથી આપણી સાંસારિક સ્થિતિ ધણી શોચનીય થઇ છે તે દીવાજની અયોધ્યતા દર્શાવી તેને અડમૂળથી ફૂર કરવાને આ પરિષદ આગ્રહ કરે છે.

છેદ્દે છુટી કોન્ફરન્સ તથા ત્રીજી મહિલા પરિષદ ભાવનગર લાવવાના નિમંત્રણુનો સ્વીકાર કરી સૌ વિસરજન થયા હતા. કે ને પદ્ધતિના ગયા પરદાર થચેલા વર્ષમાં મારવાડામાં ગોલવાડ પ્રાંતિક કોન્ફરન્સ ભરવામાં આવી હતી. અને છુટી કોન્ફરન્સ માટે ભાવનગર તરફ લોક દાઢિ ખેંચાડ રહી હતી.





શ્રી વીરચંદ દીપચંદ, સ્ટી. આઈ. ઇ., ને. પી.

ચાંદી ક્વોડામાર કો-ઇન્ડસ્ટ્રીસના પ્રેસીડન્ટ.

પાટણ.



# કોણ્ઠરન્સેનો હૃત.

## વિભાગ ૨ બો.

ડેન્ફરન્સને જેતાજોમાં પાંચ વર્ષ પૂરાં ખયાં અને છુટા વર્ષનો જામીતસર આવનમરને ઉચ્ચવા પ્રસંગ આપ્યો ત્યારે કોણ્ઠરન્સનું બાળપદ્ધ કાંદુંદેદું મઠી ગયું છે. પાંચ વર્ષ બાળકને ફરજાતનિયાળે જરૂરું જોડ્યે છે. પરેવાના પગ પાંચ દિવસ રાતા ફરજાત છે. અને તે રીતે હુદે કોણ્ઠરન્સને વાતો કરવાનો વખત વફી જવો જોડ્યે છીએ. તેવે પ્રસંગે આપણે પાંચ વર્ષના કાર્ય તરફ નજર ફેરફાય તો, જે કે ધલ્યાં ખાતાંએ ખુદ્યાં છે, પાઠશાળાએ સ્થપાદ્યી છે. અંધુકાર, ચંદ્રશૈધન, વગેરે ધર્મેવ છે જોકામત ડેળવાતો જાયછે સ્વામીમહિલા જોવાય છે પરંતુ તેજ વખતે તે કાંયોમાં ખંગીતત્ત્વ બહુ ઓછે અંશે જોવામાં આવે છે અને તેથીજ હજુ વિચાર અને આચારને અવકાશ બહુજ છે તેમ ફરજાત છે.

સંસાર સુધારો અને રીતિ રીવાળેમાં નિષ્ઠિં સુધારો થવા આપેલ છે અને તે પણ વાયા કરતાં હાર્દિક બનેલા જલ્દુંથેલ જોવાય છે. આટતા માટે સંસાર સુધારો કે જેની પ્રથમ જરૂર છે તેના માટે જુરી જુરી જાતિએ એ પ્રાંતિક ડેન્ફરન્સ પેઠે મળી ડેન્ફરન્સના કરાવોને અમદવામાં મૂદ્યવા જોડ્યે છીએ. પ્રાંતિક ડેન્ફર ન્સનું સંમેલન તેતે પ્રાંત માટે વધારે જગૃતિ કરે છે. જોક મત વધારે ડેંગદે છે. પેતાના પ્રાંતને જરૂરના વિષય તરફ વિશેષ વિચાર કરી શકે છે. અને તેજ પ્રમાણે જાતિનું સંમેલન પોતપોતાની જાનિમાં જલ્દુતા કુરીવાળેને ફરજાત અટકાવી શકે છે. કે કે અને પેટા મેળવના ડેન્ફરનાં મૂલ્ય ટેંડા રૂપે આતે રેન્ડ રંડું

ને સર્વ કર્ત્વાર્મા અગત્યના સાખન રૂપ છે તેમાં ફોઝથી ના કદ્દી શકાયે નહિ. કંબિધ્યને માટે જરૂરતા આઠત્રે વિચારો તરફ લક્ષ ગ્રંચી વાંચનારને ભાવનગર તરફ લઈ જઈશું.

### ભાવનગર

ભાવનગર કાઢિયાવાડમાં પહેલા વર્ગનું અને જાણીતું રાજ્ય છે ગદેર ભાવનગર, ખંલાતના અભાતને છેડે હરિયા કિનારે આવેલ છોવાથી અને લાંબી દેલાંએ કાઢિયાવાડમાં તેમજ ગુજરાતમાં જુદા જુદા ફાંટથી સર્વત્ર પ્રસરતી છોવાથી તે સ્ટેશન તેમજ ખંદર છોવા સર્વમ વેપારમાં આખાઈ અને દમામદાર છે. સદરડુ શહેર પ્રથમના મહારાજા ભાવસિંહલુએ સન ૧૭૨૭ માં ખાડીની સુંદરતા અને અનુકૂળતા વિચારી વસાયું હતું અને લારથી અનુકૂળે તે આગાંદ થતું આગ્યું છે. કેમકે આ શહેર વસાવનાની સાથે ગોહેલવંશ (આ રાજનાવંશની એળાખાં) ની ગાની શીહેરથી તુર્ત અતરે લાવીને ભાવનગર રાજ્યાનીના શહેર તરીકે સુકરર કર્ત્વાથી તેમજ વાપારની ખણ્ણી છુટ તથા સગવડ કરી આપવાથી જેત જેતમાં આ શહેર ખણ્ણી વસ્તી સાથે કાઢિયાવાડમાં પ્રથમ પંક્તિમાં મૂક્યું છે અને રાજ્ય વ્યવસ્થા નમુનેદાર, તેમજ અનુકરણીય અનેલાંછે. આ રાજ્યને ખંગેજ સરકાર સાથે પ્રથમથીજ ખાડુ મારો સંખંધ છે, કેમકે અંગેજ સરકારનો ડિંદમાં પગ પેઝારો થના પુર્વે સુરત સાથે ભાવન ગરનો બહુ સારો વેપાર હતો. અને તેથી અંગેજની કોઈ સુરતમાં માડતાંજ બંગેને હીક સંખંધના આવયું થયું હતું અને ત્યાર પછી પણ હરિયાઈ લૂટમાં ચાંચીયા લોકોને જુલગ વધતાં તેને છીજાભિજી કરી નાંભવાથી તેમાં વધારો થયો હતો તથા તે પછી અનુકૂળે મહારાજ અખેરાજણ, મહારાજ વાતસિંહલુ. મહારાજ જસ્તાંત સિંહલુ અને મહારાજ તખતસિંહલુ ના વખતમાં તે સંખંધને વારે મજબૂત કરવાં અનેક પ્રભું મજયા હતાં. મહારાજા તખત સિંહલુ જાંવન ૧૬૫૮માં સ્વર્ગવારી થયા ત્યારે તેમના પાઠવી કું આર અને હાલના નેકનામદાર મહારાજ સર ભાવસિંહલુ કે, સી. ઓ.સ. આઈ. મહાદ્વાર તખતાનરીન થયા.

શામળાસ ડેવેજ, ચર તખતસિંહલુ, ઓસ્પીટાબ, તખ્ટોખર, બાઈન લાઇફ્સેરી, બંડર, ઇવાપરી, વગેરે તેમજ હુજર જિપોગ માટેનાં કાષડ, બરકે, લાકડલહેરના કારખાનાં જેગા લાયક છે. કે જે પેફ્રી કેટલાકનાં ચિત્રે: અમારા વાંચક વર્ગ માટે આ સાથે રણુ કર્યો છે.

**કેન્દ્રકરસ માટે રણુ થનાર ઠરાવનો સુસદો.**

આ પ્રમાણે સ્થાનિક સિધ્યાતનું હિગાર્દીન કરવા પછી અમી ડે નિરંસમાં રણુ થનાર કાર્ય તરફ વાંચનારને હોરી જઈશું.

કેન્દ્રકરમાં ઠરાવો રણુ થનાર છે. તેમાં શાંતાતમાં નામદાર કુદાન શહેનશાહ જી તમાં બોર્ડરનો આનંદ માનવાનો. ત્યા નાનદાર મહુરાજ સંહેમાં આનંદ માનવાનો. અને ગયા વર્પરાં જેન ડે જમાં થએલા આગેવાન મરણો માટે દીક્ષાગીરીના ઠરાવો પકાર થએ પછી વાંચમે ઠરાવથી કેળવણીના વિષયને ફાથ ધઃબામાં આવેલ છે, એટલું નિ પરંતુ અન્યાર સુંદી તે હરબને દુંગમાં પનાની દેવામાં આવતો હો. તેને બદલે આ પ્રસંગે કેળવણીના ઠરાવને વી રતારથી ચર્ચના તથ માન મરે હોને આર નથા. ( કુદિક કેળવણી, ધાર્મિક કેળવણી, હુજર ઉદ્યોગની કેળવણી તથા સી કેળવણી ) માં વહેચી નાખવાગાં આવેલ છે.

### બ્યલહારીક કેળવણી.

બ્યલહારીક કેળવણી માટે નામદાર સરકાર અને દેશી રાજ્યો તરફથી સગવડ રાખવામાં આવેછે. અને તે ઉપરંત આગામી વોલ પ્રાંતો અને ગામેંમાં લોકુંડ બોર્ડ તેમજ નેશનવ સ્કુલો સ્થાપવામાં આવેછે. આપણો વર્ગ ઓકુંડ મોટા પ્રમાણમાં ગરીબ છતાં ગાનંદ વર્ગ પણ ટીક પ્રમાણમાં અને સળારતે મધ્યદુર છે. કે જે વર્ગો તેનો પણ સ્વતાંત્ર રૂલો ઉધારવા સરાકત થઈ શકે, પરંતુ તેની રીતે ગણ્યતરીની રૂલો ઓછવાનો માર્ગ અહુણુ કરવા કરતાં “ દરેક જૈન આગક તથા બાળની પ્રથમથીજ કેળવણી દરજાત તેમજ મફત આપવાના સાપનો મેળવી આપણાંપે જરૂરાધાત ” સ્વીકારી વેળી રીતે દુલઘાત કેળવણી ન લઈ શકે તેમને માટે મફત સા

ધનો પુરાં પાડીને પણ દરેક જૈન ખાળકો અને આગામીની અતુલિતતા સાચવવા માટે યોગ્ય સગવડ ઉલ્લી કરવામાં આવે તો તે ઓછું ખુશી થવા જેવું નથી. કેમંક તેટલાથી યોડા વખત પછી દરેક જઈન કુંટુંબ કેળવાએલ ઉત્પજ થધ શકૃતાથી ધર્મ શ્રદ્ધા અને વ્યવહાર સુધારામાં આગાળ વધવું એટલું તો સરલ અને અતુલિત થધ પડ્યો કે જેથી ભવિષ્યમાં બીજા કોઈ પણ ખાતા માટેનો અર્થ હશે. ઓછી થવા સાથે કાર્યવાહુકોને માટે સહાયકો અને આ રીતે ધારકેનું પ્રનાણ વધવાયી બહુ ઠીક થધ પડ્યો.

આ સિવાય મુંબનું, પુના જેવા ઉચ્ચ કેળવણીના સ્થાનો માટે જૈન યોડીંગો ઉધાડવા તથા સ્કેલરશિપો અને ફી યોર્ડરેની સગવડ કરવા તથા ફેલોશીપો અને લેક્ચર શીપોસ્થાપવાની જરૂરીઅાત સિવિકારવામાં બહુ ડાયાપણ વિચારવામાં આવેલ છે. સ્કેલરશિપો વગેરે ખીન સગવડવાળાને સહાય તરીકે જરૂરનાં છે, એટલું જ નિઃપત્ત ધનવાન અને ગરીબ દરેક વચ્ચે સ્પર્ધાનું એક હૃથીમાર છે. જુદ્દેલરશિપો તેમજ ઈનામી સ્પર્ધાથી અક્ષયાસીએને આગળ વધવા માં એવડી ઉલટ આવે છે. તથા ન ધારેલ કાર્ય સાધ્ય કરી શકે છે. તેમજ રહેવા આવતાના સાધન સંગંવની ગેરહુાજરીના કારણે આગળ આવનારાને માટે રોમજ આપણું અજ્ઞાત સંસારની ઢીં રસ મમાંથી ખાળકો પોતાને મરો ઉપરની સગવડ છતાં ચોકાંત અક્ષયાસ અહુ નિઃ મેળાની શકૃતાથી વળનો વખત ફેલપડી વખત અને પેસો ખરણાદ કરે છે તેમને માટે યોડીંગો અશીર્વાદ સમાન છે. તેમ આપણે સૌ અદ્યા અતુલવ પછી જેદ્ય શક્યા છીએ અને તેથી ઈચ્છિશુંનું કે વિપરોક્તત ઠરાવ તરફ જૈન પ્રજા પ્રથમ તકે લક્ષ આપી તેવીજ યોડીંગો ઉલ્લી કરવાની જરૂર વિચારશે.

છેદ્વે અંગ કસરતના સાધનોની જરૂરીઆતને પણ વીસતી જવાગાં આવેલ નથી તે વિચાર હુદની પરિમીમા દર્શાવે છે. હુલ અચપ્રષ્ટથીજ પોતીથનને સ્વાલ ખાળકોના મગજમાં ધૂંચોં જવા

પામેછે. અને તેથી આપણી દેશી શરિર પુછિની રમત ભમતોમાં બેદાવમાં પણ તે શરમ સમજે છે. અને બેડાવા ખારે છે તો અનુકૂળ વખતના અથવા સ્થાન અને જાધનના અભાવે તેમજ બાળપણથી પડતી કિપાધીના અસાધારણ ભારતું વહુન નથય શકવાથી અંગ કસરતની ગેરહાજરીમાં શરીર કૂષ અને નિઃસત્ત્વ થવા પામેછે તેને માટે અંગ કસરતના જાધનોની અનુકૂળતા આંચિર્વદ સનમાં થએ ખડે તે સ્વાભાવિક છે.

### ધાર્મિક કેળવણી.

ધાર્મિક અભ્યાસ બાળકોને સુલભ યાય તેટલા માટે કુમવાર વાંચન માળા તૈયાર કરાવવાની અને તે વાંચન માળા જેને ગોડીંગેમાં તેમજ જેને શાળાઓમાં ચલાવવાની ગોડવણું કરવાની ધાર્મિક કેળવણીના ફેદાવા માટે પ્રયમ જરૂરીઆત દર્શાવવામાં આવીએ. અને એ પણ સમજાય ચુક્કુછે કે ધાર્મિક જીવનના સંસ્કાર વિના બાળવય પસાર થવા હેવી તે ભવિષ્યને માટે બાળકને કષેત્રી સ્થિતિમાં અને ભ્રમિત વિચારોમાં જેંબી જરાંહી અણી ઉપર લાવી સુકે છે. પરંતુ અભિયાન જેતું એહે કે કેંનરંગના જન્મની સાથેજ વાંચન માળાની જરૂરીઆતનો ઠરાવ પસાર કરવા છતાં અલ્યાર સુધી તેના માટે કથી તૈયારી કરવામાં આવી નથી. આપણે પસાર કરવાના ફરાવો નામદાર સરકાર પાસે કેંચેસની પેઠે દાદ માગવાના નથી. પરંતુ જો અમરતમાં મૂલ્યાના હે. અને તેમાં પણ વાંચન માળા તૈયાર કરવાના ઠરાવનો ગમદાર તો આપી જેને કેમ મળીને નહિ પણ અમુક વિદ્યાન વ્યક્તિનાં માંણ પાસે તૈયાર કરાવવા સંબંધેનો છે. છતાં અદ્યારી તે માટે કથી તૈયારી કેમ થવા પામી નથી તે સમજ શકાનું નથી, અર્થાત એ વાત અરી માનીએ કે એક ધોરણ સત્તા વાર નકટી કરણું હું તે માટે પુણી ચર્ચા, સૂચના અને ઓછ ખાપણું ણહાર જાવે તે! તેનું છેઢણું રવરૂપ બહુ સંતોષ કારણ થઈ શકે. અને તે પ્રગણે ચુક્કરાતી બાધાની છેદલી સર્ટીમાં થબેલી સારા પ્રમણુમાં ખીલવણી પણ નવા ધોરણ પ્રમાણે તયાર થબેલી વાંચન

આગામે આખારી છે, તે છતાં હેઠળ શુજરાતી વાંચનમાળા તૈયાર કરવા પુરો મોડા વખત ભાજમિત્ર અને અને નેવાં સામાન્ય પુરતકેથી ચલા વચા પણી વધારે વખત તેવી ટિકાની રહુમાં ઓચામાં આવ્યો નહોતો પરંતુ તેવી વાંચનમાળા તે નાર કરી તેમાંથી વર્ષો સુધી અભ્યાસી એને ડાચેજન આપી છેવડ હાજ નવી વાંચનમાળાનું સ્વરૂપ ઉલું કરવામાં આવેલ છે. આ તકે જણાવવું નોઈએ કે બિપરોક્ત વાંચન માળા તૈયાર કરવામાં ને સર્વે દેખી વિચાર કરવાનો હુતોં નાનિ સાથે વ્યવહારને નેડી ઇતિહાસ, ભૂગોળ, સૃષ્ટિ સૌંદર્ય અને કાર્ય દ્વારાના પાડો ચોજવાના હતા તેપ્રમાણે આપણી વાંચન માળા માટે નથી છતાં તે ચોજના ઠરાવમાં પડી રહે તે વધારે હીલગીર થવાનેવું છે. આપણી વાંચનમાળા માટેનું ધોરણું ઘડવામાં પણ પુષ્કળ ચર્ચા વાખી વિચાર ક્ષેત્ર વિકાસમાં છે, તેમજ તેવી વાંચનમાળાની સ્વતંત્ર વિદ્વાનોથી તૈયાર થયેલ સીરીઝો ( પંડીતલાલનાની માર્ગ પ્રવેશીકા અને ગ્રારંભપોથી વધુયદી લૈનશાળાની વાંચનમાળા—પાલીતાણુના, વિદ્યા પ્રકારક વર્ગની વાંચનમાળા—વગેરે તૈયારછે. અને સેડતલાકચંદ માણ્યુકનંદ પોતાને અર્થે મી. મનઃસુખ કિરિતચંદ આશ્વર બનંદું પાસે નવી વાંચનમાળા બર્ન બિપરાંત વખતથી તૈયાર કરાવે છે. આ પ્રમાણે અડેક વ્યક્તિના મગજથી થતી સિશિંને વધારે વખત રેાકવા છતાં તેને માટે સ પ્રમાણું સર્ટિફીકેટ અથવા ટેક્સ બુટ પાવર મળી શકતો નથી અને તેથી તાકીદે વિદ્વાનોની કુમિટિથી અથવા પાઠની સંકલના તૈયાર કરી તે તે પાડો જાણીતા અને સમજું જુદા જુદા વિદ્વાનો પાસે વખાવી માંગી તેને સ્પર્ધામાંથી પસાર કરતાં છેવડ સીરીઝ તૈયાર કરાવી પહેલી તકે હુવે બહુર મુક્કાં નોઈએ છીએ અને તે પ્રમાણે તાકીદે થશે તેમ આપણે માનીશું ).

બીજો સ્વાસ જૈન પુરુષક વગોં અને ક્રીરીર્દિગ ઇમો જોલાલવા જાંબંધેનો છે. વાંચન સીરીઝ જેમ આળકેને જમાનો ઓળખાંથી માટુસાયમાં લાખવાનું જરૂરનું આપુન છે. તેમવત્તમાન સ્થિતિથી જાંબણું આજુ વખતમાંથી પસાર થતું એ અંધારી રાત્રીમાં અલાદ્યા

રસ્તા વચ્ચેની મુશ્કેલીથી પણ બધારે મુશ્કેલ છે. અને તેથી તેવી રંગીમાંથી પદ્માર થનાને પ્રકરણિપે સ્થળે સ્થળે લાયથેરીએ. અને મુલાડાતરો, જે લાવણ્યાનું બની શકે તો સંપૂર્ણ લાભ પ્રદ છે ફેલકે તેવા સાખનો ધાર્મિક ઉપરાંત વ્યવહારીક હેળવણી માટે સર્વોત્તમ મદદગાર સાધન થઈ પડશે.

આપણું ધાર્મિક શયોના પ્રાચીન ભાંડારો એટલા બધા કિમતી અને વાખાલું ચોગ્ય છે કે તેનો નમુનો ખીજુ કોઈપણ પ્રણ હે કોન લાગ્યેજ ધરાવી ગયું છે પરંતુ અઃપણી અજ્ઞાનતાએ તેવા ભાંડારને અદ્યાથી અંધારામાં રાખી મુક્તા તેમજ તેવા છુટક અંધે કિન્જ કિન્જ સ્થાને પડી રહેવાથી આપણું કિમતી સાહિત્ય બહુ વિભાગોમાં વહેંચાયજવા પામેલ છે. આપણો અકેક અંધ મુરોપ અને અમેરીકાને નવા હુનર જીપોણમાં આગળ વધારે છે એન્ટલુંજ નહિ પરંતુ અલ્યાર સુધીમાં થયેલી કિમતીમાં કિમતી શોદુ જોખ પણ નૈન અથેની બહુાર નથી તેમ આપણે મળેલ સાહિત્યથી પુરૂષાર કરી શક્યે તેમ છે તો પર્યાત્માં છુપાં અને જાડેર પણાંએ. તેમજ અંધો તથા શાસ્કેના હુસ્ત લીખીત તેમજ છારેલ દરેક અંધો એકજ સ્થળે હોય શકે તેવી ચોજના માટેની સંકલના અમલમાં મુકાય હોય. બહુ લાભપ્રદ થઈ પડશે.

વાગી માત્રપીલાંખા તે આપણું શાસ્કાએનની ચાવીછે. અને તેથી તેના ખીડુનણીથી અપણે કિમતીમાં કિમતી ખણનો શોધી અમુલ્ય રત્નો પ્રાપ્ત કરી શકીશું, તેથી માટે માગધી કોણ તેમજ ડાક્ટર ભાંડારકરની સંસ્કૃત બુકોની ટથે માગધી બુકો રચાવણ તેમજ તે ભાવા સુનીવર સીટીમાં સેકન્ડ ઝંગવેજ તરીકે દાખલ કરાવવાનો પ્રયાસ પણ તેઠોઝ જરૂરનો છે.

ઉપરના કરાવો અમલમાં લાવણ્ય દ્વારાયક તથા ચિકાય આપવાર ચિકાયકો તેથાર કરવાના આપ ઉદ્દેશ્યથી બનારસ ખાતેની શ્રીમદ શાસ્કેનિશ્વરજ જધન પાઠચાળા આપણી કોમે ભાતખર સંસ્કા લર્હિ મત હરીછે. છતાં તે આશ્ચર્ય અને ધૂઢાએ અલારે અમલમણ

ન આવી શકવાની સ્થિતિમાં હોવાથી તેના ધોરણુમાં સુધારે। કરવા માટે કોનકરંસે જરૂર વિચારી જિપરોક્ત પાઠશાળાને કોનકરંસના આશ્રયની નીચે સુકીછે અને તેથી આશા રહેછે કે તેથી હવે ધોરણુ તૈયાર થતાં તે પાઠશાળા સુળ જિહેશને ખર લાવતી થશે.

**હુનર ઉદ્ઘાગની કેળવણી.**

ઉપરની બંને કેળવણી સાથે હુનર ઉદ્ઘાગની કેળવણીને પણ વિસારી મુક્તવામાં આવી નથી તે ખાસ આનંદને વિષય છે. હુનર ઉદ્ઘાગ ભવિષ્યના વ્યાપારનું છુનાન છે. કેમકે તેવા હુનર ઉદ્ઘાગ તરફના હુક્મશે આપણા પ્રદેશનેતદન પણત સ્થિતિમાં મુક્તાછે એટલુજ નહિ પરતુ એક નજીવી વસ્તુ માટે પણ આપણને પારકી પ્રલ જિપર અને પરદેશ જિપર આધાર રાખી મોં વીકાસી બેરી રહેનું પડેછે. આ સ્થિતિ માંથી ખચના માટે હુનર ઉદ્ઘાગ તે સખળ હથિયાર છે. અને તેથી આ ઠરાવની આપણે ક્રેડિટ છચ્છીશું

**સ્ત્રી કેળવણી.**

કેળવણીના ચોથા ભાગમાં સ્ત્રી કેળવણીનો સમાસ કરવામાં આવેલ છે. અહસંસાર સરલ થવાને સ્ત્રી એ બીજું ચક છે. અને તેથી બંને એકની સમાન સ્થિતિ નિરવિધિ ગમન કરવામાંઆધાર ૩૫ થઈ પડેછે. સ્ત્રીઓને ચગદીમારવાના વિચારો હવે આપણે છાડી હેના જોઇએ છીએ. અને તેટલા માટેજ સ્ત્રી કેળવણી જરૂર નો વિષય છે. વાંચનારને યાદ આંપવાની જરૂર નથી. હે કેળવા એલ સી ગુહ ફાર્નેનો સંપુર્ણ ભાર જિપાડી લેછે. અને તેથીજ સ્ત્રી કેળવણીની ખાસ જરૂર છે વળી સ્ત્રી કેળવણીના વિષયના પણ ગ્રંથું ભાગ રાખવામાં આવેલ છે તે વધારે ઝુશી થવા જેવું છે કેમકે એક તરફથી કન્યાઓને કેળવવા માટે વિચારવામાં આવે છે ત્યારે બીજી તરફથી મોટી ઉમરીની સ્ત્રી માટે ધ્ય

મેંક જ્ઞાનની સગંડ અને વિધવા ( ઉદર નિર્વાહ જરી ભ  
હેઠત ઉપર કરતી ) ક્રીઓને માટે નૈતિક ભાયે હુમ્બર ઉઘોગ  
ની ઢેળવણી આપવાનો વિચાર કરવામાં આવેલ છે. એ કે થો  
જુનાથી આપણો ગાંગ નાતડાલીક સર્વા થઈ શક.

ઉપરના સંવાદ કેળવણીને લગતા ઠરાવો તેનો સતતર અમલ  
થવા માટે છેદને એ. યુડિશન એડ સ્થાપનાને વિચારવામાં આવેલ છે  
તે સૌથી વધારે ખુલ્લા થવા જો એ કે કેમડ ઇને આપણે થતા ઠરાવો  
અમલમાં મુદ્દાભેવા જોડને સંતોષવાનું છે તેમ પ્રથમજ જણાવ-  
વામાં આવેલ છે.

### કોન્ફરન્સનું ખંધારણ.

આ સધ્યાં છતાં આવા ઠરાવો પસાર કરવાની પ્રથમ જરૂર  
છે તે આપણે નિસરી જવું જોઈનું નથી. અને હાન્ડરન્સના કાર્ય  
વાહકો પણ તે વાતને ખાસ અગત્યની સમજતા આપ્યો છે. પરંતુ  
ને બંધારણના ખરડામાં હજુ દરર્ખ આંગે વધતો સુધારાનો અવ-  
ક્ષારી જોવાતો આવંછે. અને તે પછી છેદને હને પછી તે માટે વધારે  
અનુકૂળ સુધારો કરવામાં આવેલ છે. જેમાં એક અને બીજી હાન્ડ  
રન્સની વર્ણના વર્ખતમાં ચલવલ રાખવા માટે જનરલ અને  
પ્રેવીન્સીયક સેક્રેટરીઓ ની ભવા અને તેમના ભાઈની તથા જરૂર  
પડતાં ડીરટીકટ સેક્રેટરીઓ ભાઈની જામતી રાખવા અને તેમના  
વર્ષતા રિપોર્ટ અનુકૂળ મેળની બીજી કોન્ફરન્સ પ્રસંગે રજુ કરવા  
કરવનામાં આવ્યું છે. આ ઠરાવ અગાઉના ઠરાવની પુનઃધાર ૩૫  
સાડજ સુધારા સાથે રજુ થયો છે ત્યારે જે નવું તત્ત્વ રજુ થનારથે  
તે ડેલીગેટોની સંખ્યાના પ્રમાણું સંબંધે છે. ડેલીગેટોએ તેનું ગમના  
સમગ્રયં પનું પ્રતિનીધિત્વ લઈને આપેછે અને તે રીતે ડેલીગેટની  
મહત્ત્વા, અનુષ્ઠાન, ડાપણ, ઉત્સાહ, અને દઢતા એટલાં તો વખ્તાખ્તા

દ્વારા જોઈજો હે તે ક્રિજ સમજવા પછી ડેલીગેટ ચુંટાતા હતે તો પમાર કરેલાં પાંચ વર્ષમાં, અરસાધારણું રીતે ગ્રામને ગાંગળ વંદી શક્ય હતે. એંતું ખેડની કાત છે કે ડેલીગેટનો અરો એવી લોકો સમજતા નથી. ડેલીગેટની ક્રિજ અને જો અમનું ડેલીગેટ થતારને નહિ પરંતુ ચુંટનારને પણ કેટલેક અંશે આછું જ્ઞાન જોવાયછે અને તેથી ડેલીગેટ વખત ડાન્ડરનસાચે મેળાનું ભીજ્ઞું રાય થઈ પડેલે. આ સંબંધી અગ્રસમજ હુરથના ડેલીગેટની કંઈક હુદ્દ બાંધવા જરૂર લાગા વખતથી જોવાતી આવેલે અને અંતે તેની જરૂરીઓાત ભાવનગરે સ્વીકારવાનું ડાખાપણ વિચાર્યું હે જેને અંગે તે નીચે પ્રશ્નાણે ઠરાવ પસાર કરવા ધારેલે.

### ડેલીગેટનું પ્રમાણ

આ ડેલીગેટની સંખ્યા ચોકસ હુદ્દમાં લાવવા માટે દરેક સો ધરે પાંચ ડેલીગેટા આવી થકે તેવી વ્યવસ્થા કરવી તેમાં પાંચથી આછા ધરવાણા ગામોભાંથી પણ એ ડેલીગેટ મોકલી થકાય તેવી સત્તા આપવી. અને સમાચ્ચે વગેરે સંકદે દૃશ્ય ચુંદી થકે તેમ દરાવવું.

બ સુખ્ય સુખ્ય સંસ્થાને મેઘરોની સંખ્યા અને સંસ્થાની મહત્વતાના પ્રમાણમાં અસુક ડેલીગેટ ચુંદી નોકલવાની સત્તા આપવી. ડેલીગેટની ઉમર અધાર વર્ષથી નાની ન જોઈજો અને ઠરાવેલ સંખ્યા કરતાં વધારે ડેલીગેટ મોકલવન ની ડોધ્યપણું ગામક સંસ્થાને જરૂર જણાય તો તણે તે વગાની રીસેપ્શન કનિટિની મંજુરી મેળવવી.

ક ચેન્યુએટો, સંભવીત અહુસ્થો, અન્ય વિદ્વાનો અને જાહ્નન ચોપાનીયા અને ન્યુસપેપરોના અધિપત્રાઓ વગેરેને ડેલી-ગેટ તરીક આવવાનો હક્ક આપવો.

આ પ્રમાણે પ્રમાણુ મુફ્તર થવા પછી માની શકીયું કે ડેવીને  
ગેટ માટે થતી ચુંટણી ખકુ આવડારદાયક થતા સાથે સૌ તેની  
ખરી કિગત નમજનાં શીખશે.

ઉપરનું ડેવીનેટનું પ્રમાણુ ડોન્કરન્સના ખર્ચમાં પણ ખદુ  
લાભકરનાર થછ પડવાથી ડોન્કરન્સને ભર્ણિયમાં નિમંત્રણ કર-  
નારને વધારે અનુકૂળ થઈ પડ્યો. એટલું છતાં વળી તે ઉપરાંત  
ડોન્કરન્સની વધારે વિશ્વાસ યુક્ત દઢતા ખર્ચની હદ્વાળી અનુચૂ-  
ણતા કુંચર આધાર રાખતી ડેવાથી તે પ્રમાણે ઓછા ખર્ચે  
ડોન્કરન્સ ડાર્યમાં આગળ વધી શકે તેટલા માટે નિયાર કરવા  
સારુ એક ખાસ ડનિટ નીમના અને તે ડનિટ પોતાનો રીપોર્ટ  
આ ડોન્કરન્સ પછી વણ માસમાં બહાર પાડે તેવા ઠરાવ કર  
વાતું જણાવી ડોન્કરન્સના ભર્ણિયની આર્થા યુક્ત દઢતા આટ  
જે નિયાર ચોજવામા અવેલ છે. તે ખદુ ખુશી થવા જોગ છે.

### દાનીડારક રીવાજો

હવે આપણે આગણા રીત રીવાજ તરફ દિલ્લી ક્રેરવશું તો  
સંસારની સરેલતા આત્મ કદ્યાશુના ગાર્ગનું પ્રથમ પગણિયું છે.  
બગડેલા યાને સડીગયેલા આપણા સંસારે આપણે આચાર વિ  
ચાર અને રહેણી કરણીમાં ખદુ । જો પાડી દીધા છે, અને તથી  
રીત રીવાજ સુચારનાને આગળ વધુ ગાના ભર્ગને ભરલ કરવા એ જ  
રૂન્નો નિષ્ય છે. આના રીવાજના સંબંધમાં આપણું દરેકને શુભ  
શુભ પ્રદાનગપર આત્મવું પડેલે. એટલે કે લગ્ન પ્રસંગમાં કન્યા નિ  
ક્ષે, વૃદ્ધ નિરાઢ, એક કરતાં વધારે ક્રી કરવાનો રીવાજ. બળજાન  
નેરથા નૃન્ય કરવાના. દાદાઓનું તેઓનું દાદાઓ ગાંના. ધર્મચિહ્ન  
મિત્રથ લગ્ન કિયા રહ્યો હો નાંદે રે કુઠા ! ! જે ચાલેલે તે તથા  
મરણ પ્રસંગે નમરાલા : ૧૫૩, ૧૫૪, ૧૫૫ ૫૪૪ જમણાં,

અને કરજીઆત ખોટાં ખર્ચેં તેમજ ભીથ્યાત્વ પર્ણ સેવનથી ખર્ચવા જરૂર છે.

જીપરના કુરીવાએ પૈકી કન્યા વિહૃય, ખાળ લગ્ન અને વૃદ્ધ વિવાહ દૂર કરવા અથવા યોગ્ય અંકુશ સુકવા માટે વિચાર ચલાવવા અનેની રીસેપ્શન કમિટી ( ડારસ્પેન્ડન્સ કમિટી ) એ હિલચાલ કરી હતી. પરંતુ તના ઇણરૂપ કરો લાલ થચેલ જોવાઈ રાકૃતો નથી. તો તેને માટે કર્દીક આવકાર દાયક યત્ન શરૂ રહેશે. તેમ ધર્મછીશું.

### તિર્થ રક્ષણુ.

રજુ થનાર ડરાનોમાં આ ઉપરાંત સમેત શિખરની પત્રિતા જગતવાના સ્વાલને પણ સમાસ થાય છે. આપણા તિંદ્યાના રક્ષણુ માટે વગવાળી કમિટીની ગેરહાજરીમાં આપણા અમુદ્ય કિમતીહક્કા અને જહેજલાલીમાં ન્યૂનતા જોતાં આપણા છીએ અને તેને અંગે આપણા પાસે સમેત શિજુજનોજ નુહિ પરંતુ તે ઉપરાંત શ્રી આયુર્જ, ગિરનારજ અને સિદ્ધક્ષેત્રના સ્વાલોપણુ તૈયાર જીભા છે અને તેટલા માટે આવી તિર્થ સંગ્રહની ઇરીયા છે માટે દલધીરીના ડરાનોજ પસાર કરી હૃત હૃત્ય ન થતાં તેવી વગવાળી કમિટીથી તિર્થ રક્ષણુ માટે કાળજી નાણો બંદોબસ્ત કરવાને ડાન્ડરન્સે વિચારનું જોઈએ છે.

### સ્વદેશી ઉદ્ઘોગ અને એંક.

તેના પઢીનો ઠરાવ સન્દેશી ઉદ્ઘોગને ઉત્તેજન આપવા સંબંધે અને તે પઢી થી જૈન એંકની જરૂરીઆત સંબંધેનો છે. આ બંને ઠરાવ એકથી વધ્યારે આગત્યના છે તેમાં હાર્દથી ના પાછી શકાશે નહિ. કેમકે સ્વદેશી ઉદ્ઘોગની વૃદ્ધિ ઉપર એકની કૂતેદને, આધ્યાર

એ ત્યારે વેંડની મજબૂતી ઉપર સ્વહેલી ઉદ્દેશની જગતન્ઠનો આ ધૂર છે. અને આ રીતે ઘનેની ઇતેહ થવાથી જ જન સમાજ અને દૈથનો અભ્યુદ્ય છે. ઉદ્દીગ શિવાયની આપણા નેપારની સ્થિતી તદ્દન પરાધે મુન યંધ પડીછે. એક જીણું માંજુલી નરતુથી ગમેતેને માટે પરહેલ જીપર આધારું લટકી રહેલાં હોય. ત્યાર બીજી તરફથી અંદર અંદરના અનિ થાસે અને ધંધા જીધોગગની બીજા કાગજી પૈસા પરહેલી બેંડા ખાં કંગાલું ન્યાંજે રાખી મુકવા પડેછે. અને તેથી આ અરસા સના વાંદાઓના નીકાલ માટે અભ્યુદ્યના વિચારને જે અવકાશ મળે છે તે સંતોષ લેના લંગ છે. વર્ષી જરૂર. એકથી નાણુંની છુટ થાપણાં અને ધરણાં કર્ડા તેનજી વંચના વગેરેના પૈસાનું થવા પારશે. તો વરાગના લાગ છે.

આ સિવાય સદગુ કાન્કડનનમાં જેન બધુંનાનેરહાય આ ખાં જીણું પુણેડાદાર. જીણું વંચાદાર, જીણ દ્યા. ધારમિક નાંદાના ડિનાખ તપાસના બાબત, વાંચનમાળાની ઇરીયાદ, રસભભાં દાખલ થવા સંબંધી. તેમજ સંપ્ર વૃદ્ધ સંબંધના કરાન રજુ થતાર છે તે પણી ચોણો દનસ

### મહિલા પરીષદ.

ભરવામાં આવશે કે કેમાં દરેક ઢામ અને ધર્મની ઢાઈ પણ સીને મદ્દત જવા દેવામાં આવશે.

આ સધળાથી ક્ષારેગ થવા પણી રેખવે તેમજ સ્ટીમર હેસ્ટેય ન પાસનો જીપથોગ સાથે આનેલ તે એક સાથેજ જવાથી લઈયાદ તેમ છે. સબજ સગવડ ઢાપ તો આ તરફ પંચતિર્ય દરવા જેવું છે.

( ૫૮ )

અત્રથી નજીકતું તિર્થ ગોધા બંદર છે કે જ્યાં જવા માટે ઘેડાના ટપા  
મળી શક છે. ગોધામાં નવખંડા પારખનાથ રવામીતું જીનાલય  
છે. ગોવેઠી તળાલ, દાઢા, મહુવા, ઝુટવડા એ વગેરે હુરે હુરના  
ગામો છતાં જીનાલયો ભીન્ય હોવાથી લાભ લેવા જરૂર છે. અને  
આ રીતે યાત્રા ફરી છેલ્લે શ્રીસિદ્ધાચળની યાત્રાનો લાએ લઈ  
છેન્ટ પલીતાણેથી સોનગઢ સ્ટેશનેથી રેલવેની સફર શરૂ થયેછે,

---



सरतामांसस्तुं नैन वर्तमान  
जैनशुभेषणक

જૈન બાંધુઓમાં વાંચન શોખ વધ્યોએ  
વધારે ખર્ચ કરી શકવાની સગવડતાના અસાવે, અથવા જોઈએ  
તેથું સ્વતંત્ર લખાણ ન મળવાથી તે શોખને પરિતૃપ્ત કરી શકતા  
નથી. અને તેટલાજ માટે અમારા તરફથી જનેવારીની પહેલી  
તારીખથી જૈન શુભેચ્છિકુ એ નામનું એક પાકિસ્તાન  
જૈન વર્તમાન પત્ર દરેક માસની તા-૧ લી અને ૧૬ મીને  
ત્રણ ઝર્મનું અતેથી બાહુર પડેછે. કંઠા સ્વતંત્ર અને જીવા  
જીવા વિકાનોની કલમથી ડોમના હિતના દરેક સ્થળોના સ્વતંત્ર  
વિચારો શુભરાતી લાખામાં ચર્ચ્યાવા ઉપરાંત સર્વહેશીય નવા  
અગરો પુરા પાડવામાં આવેછે.

## સૌઠર્ય ( વાર્તામાળા )

૬૨ પખવાડીએ બહાર પડે.

મનને આનંદ આપનાર ગોધદાયક-ગૈરિતહૃસિદ્, રસીક વાર્તા  
આને: સમુહ દાગુલ કરવામાં આવેછે. ને વાંચતા ઉદાસ થયેલ  
મન તુર્ત શાંત થાય છે, એક વળત હુથમાં લીધા પણી મુંડાનું  
મન થતુંજનથી. લાપા સરલ લેવામાં આવેછે. ઈંગ્રિત વર્ષ એકના  
ટપાદસહિત હે. ૨-૬-૦ અગાધિથીજ લેવામાં આવેછે, નસુ-  
નાનો અંક એક આનાની ટીકીટ મોટલવાથી મદત મોકલવામાં  
આવદો. આહુક જેગ ઇકત નકદો છપાઈછે, પૈસા આવ્યા સિવાય નામ  
નોંધવામાં આવશે નહીં. પત્ર વ્યવહાર નીચેને શરીરનામે કર્દો.

पुढेतमदास गीगालाई राह.  
मालीक धी “विद्या विजय” प्र. ग्रेस.

ਆવનગર—રાંધનયુરી પાલર.